

## અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

વેબસાઈટ :- [www.egovamc.com](http://www.egovamc.com)

એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન ખાતુ  
(મધ્યગ્રેન)

માહિતી અધિકાર અધિનિયમ - ૨૦૦૪

અંતર્ગત કલમ ૪ (૧) બી (૧) મુજબ

ખાતાનું પ્રો - એક્ટિવ રીસ્કલોઝર

અધતન કર્યા તારીખ - ૧૨/૦૭/૨૦૧૭

(૧) વ्यवस्थातंત्र, કાર્યો અને ફરજો:

(અ) વ्यવस्थातंત્ત્ર

ઓર્ગનાઇઝેશન ચાર્ટ

ડે.મ્યુનિ.કમિશનર



આસી.મ્યુનિ.કમિશનર



પ્રથમ અપીલ અધિકારી અને  
ડે.એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર



ટેક્ષ વિભાગ

જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર

વ્યવસાયવેરા વિભાગ

જાહેર માહિતી અધિકારી અને આસી.મેનેજર

ડીવીઝનલ સુપ્રિ

વહીવટી બ્રાંચ

ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ



- (૧) શિરસ્ટેદાર / ડે.શિરસ્ટેદાર
- (૨) જુની.લીગાલ આસી.
- (૩) જુની.કલાર્ક - ઈન્વર્ડ કલાર્ક

વોર્ડ ઈન્સ્પેક્ટર (સીની.કલાર્ક)

- ઠરાવ કલાર્ક
- બિલ કલાર્ક
- કન્ટીજન્સી કલાર્ક

વોર્ડ ઈન્સ્પેક્ટર

જુની.કલાર્ક

જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારી અને  
ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર



નોડલ ઓફિસર મદદનીશ :-

માહિતી અધિકાર અરજી કામગીરી અને  
આસી.મેનેજર ટેક્ષ



ડીવીઝનલ સુપ્રિન્ટેન્ટ (જે-તે બીટ )

ખાડીયા      રાયખડ      કાળુપુર      શાહપુર      માધુપુરા      શાહીબાગ

## (બ) કાર્યો અને ફરજો :-

એસેસમેન્ટ એન્ડ ટેક્સ કલેક્શન ખાતા દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોઈ વિસ્તારમાં આવેલ તમામ મિલકતો ઉપર મિલકતવેરો ઉધરાવવાની કામગીરી કરવામાં આવે છે. મિલકતોમાં રહેઠાણ તથા બિનરહેઠાણ મિલકતોનો સમાવેશ થાય છે, જે સાથે જ ભાડુઆત તાબે કે માલિક તાબે મિલકતો વપરાશમાં હોય છે. આ ખાતા દ્વારા ટેક્સની વસુલાત માટે દરેકપ્રોપર્ટીનું એસેસમેન્ટ કરવું જરૂરી હોય છે.

કરદાતાઓ તરફથી આવતી નીચે મુજબની અરજીઓનો નિકાલ ટેક્સ ખાતા દ્વારા કરવામાં આવે છે.

- મિલકતની માલિકીના નામ ટ્રાન્સફર અને મિલકતના કબજેદારના નામમાં ફેરફાર કરવા.
  - બી.પી.એમ.સી. એક્ટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબ વપરાશના પ્રકારના ધોરણે મિલકતની આકારણી ધરાડવા અંગે
  - એકજ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાના બિલ ૨૬ કરવા અથવા સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તો વપરાશના ધોરણે જુદા જુદા બિલ કરવા અંગે
  - મિલકત ખાલી/બીનવપરાશ અંગે નોંધ રાખી ખાલી મિલકતનો ટેક્સ રીફંડ મેળવવા.
  - નવી મિલકતનું એસેસમેન્ટ કે જૂની મિલકતોનો વપરાશ બદલાયો હોય, ભાડાના દરમાં ફેરફાર થયો હોય તો આકારણી રીવાઈઝ કરવા અંગે
  - મ્યુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ આપવો.
  - ચર્ચુવર્ષિય આકારણીના વર્ષ જાહેરનામાની મુદ્દતમાં વાંધા અરજીઓ સ્વીકારી એપેલેટ ખાતા દ્વારા તેનો પુરાવાના આધારે, સ્થળ તપાસ કરી નિકાલ કરવામાં આવે છે.
- નવી મિલકતોની આકારણી અથવા આકારણી રીવાઈઝ કરવા માટે

નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર ભાડુઆતના ધોરણે વપરાશ કરવામાં આવતો હોય તેમજ વપરાશમાં ફેરફાર થયેલ હોય તો આકારણી રીવાઈઝ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નક્કી કરેલ ફોર્મમાં અરજી સાથે

- (૧) રહેઠાણ માટે મિલકતના માલિકીના પુરાવાની પ્રમાણિત નકલ, જમીન માલિકીનો ૭/૧૨ નો ઉતારો, ઓર્ગેનાઇઝર પાસેથી કબજો મેળવ્યો હોય તો તેની કબજા પહોંચની પ્રમાણિત નકલ, રેશનકાર્ડ, ગેસ કનેક્શનના પુરાવા તથા
- (૨) બીનરહેઠાણ માટે ગુમાસ્તાધારાનુ લાઈસન્સ, સેલ્સ ટેક્સ રજીસ્ટ્રેશનની પ્રમાણિત નકલ, વીજળીનું બીલ, ટેલિફોનનું બિલ રજૂ કરવા.

જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો ર૨૬ કરાવવા માટે

જૂની મિલકત જમીનદોસ્ત કયારે થઈ તેના પુરાવા, જુની મિલકત તોડી પાડ્યા અંગેની અરજી આપેલ હોય તેની પહોંચની ઝેરોક્ષ, નવી મિલકત બાંધવા અંગે ખાનની વિગત, બી.યુ.પરમીશન કયારે આપવામાં આવી છે તેની વિગત, નવી મિલકતની આકારણી ટેક્સ ખાતા દ્વારા કયા વર્ષથી કરવામાં આવી છે તેની વિગત, ર૨૬ કરવાના બિલોની ઝેરોક્ષ નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

## સમગ્ર મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

સમગ્ર મિલકતનું એક બિલ આવતું હોય તેના બદલે જગાના વપરાશ મુજબ મિલકતના ભાગલા પાડીને તે મુજબ ટેક્સના બિલ મેળવવા માટે, અરજી ફોર્મ સાથે બિલની પ્રમાણિત નકલ, ભાડુઆત તાબે મિલકતના ભાડાના પુરાવામાં ભાડા કરારની પ્રમાણિત નકલ રજૂ કરવી.

### ● મિલકતના કબજેદારમાં ફેરફાર કરાવવા માટે

અરજી ફોર્મ સાથે જૂના ભાડુઆત મિલકત ખાલી કરી ગયાનો પુરાવો / કબજો સૌખ્યાનો પત્ર /કબજી કરારની નકલ, નવા ભાડુઆતનો ભાડા કરાર, ભાડુઆત ખાલી કરી ગયા હોય તો તે અંગે અ.મ્યુ.કોર્પો. ને જાણ કર્યા અંગે અગાઉ અરજી કરેલા હોય તો અરજી કાર્ડની નકલ, પ્રોપર્ટી ટેક્સના છેલ્લા બિલની નકલ સામેલ રાખી નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

- મિલકત ખાલી / બીનવપરાશ (નોન યુઝ) અંગેની નોંધ રાખવા માટે:

જે તે નાણાંકિય વર્ષમાં અરજી સાથે પ્રોપર્ટી ટેક્સના બિલની નકલ રજૂ કરવાથી, જે તે નાણાંકિય વર્ષમાં મિલકત ૩૦ દિવસ કરતાં ઓછા સમય માટે ખાલી હશે તો મિલકતવેરાની રકમ મજરે મળી શકશે નહિ. જે દિવસે અરજી આપવામાં આવી હશે તે તારીખથી ખાલીનો લાભ મળી શકશે. દરેક નાણાંકિય વર્ષમાં મિલકત ખાલી રહેવાની હોય તો અગાઉથી અરજી કરવાની છે. વર્ષના અંતે ખાલીનો લાભ આપવામાં આવે છે.

- મ્યુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ કરવા માટે

મ્યુનિસિપલ વેલ્યુઅશન અપીલના ચુકાદાની પ્રમાણિત નકલ રજૂ કરવી. છેલ્લા બિલની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

- એક ૪ મિલકતના બે બિલ આવતાં હોય તો વધારાનું બિલ રદ કરવા બાબત.

અરજી સાથે ચાલુ બિલ તથા રદ કરવાના બિલની પ્રમાણિત નકલ સામેલ કરી નિયત ફોર્મમાં અરજી કરવાની હોય છે.

- બી.પી.એમ.સી. એકટની કલમ ૪૮૫/૧,રૂલ-૨૦ તથા સરક્યુલર નં.૧૪ મુજબ મિલકતની આકારણી ધરાડવા માટે

નવી ફોર્મુલા અમલમાં આવ્યા બાદ નીચેનામાંથી કોઈપણ ફેક્ટરમાં ફેરફાર થાય તો ૪૮૫/૧ મુજબ મ્યુ.કોર્પોરેશનને અરજી કરવાથી ટેક્સમાં ફેરફાર કરી આપવામાં આવે છે.

કારપેટ એરીયા: કોઈપણ મિલકતમાં કારપેટ એરીયામાં ફેરફાર હોય તો તે અંગે નિયત ફોર્મમાં અરજી કરવાથી સ્થળ તપાસના આધારે ફેરફાર કરી આપવામાં આવશે.

ફેક્ટર-૨ મિલકતના બાંધકામના વર્ષમાં ફેરફાર હોય તો ટેક્સમાં ફેરફાર થાય. અરજીાર બાંધકામ વર્ષના પુરાવા સાથે અરજી આપે તો સ્થળ તપાસ કરી ટેક્સ ધરાડી આપવામાં આવશે .

ફેક્ટર-૩ મિલકતના ઉપયોગ આધારિત ફેરફાર થાય તો જરૂરી પુરાવા રજૂ કરેથી અરજી કરવાથી ટેક્સ ધરાડી આપવામાં આવે છે.

ફેક્ટર-૪ માલિકી સંબંધિત ફેક્ટરમાં એટલે કે ભાડવાતમાંથી માલિક થતા હોય પુરાવા સાથે અરજી કરવાથી તે મુજબ ફેક્ટરમાં ફેરફાર કરી આપવામાં આવે છે.

- મિલકતના નામ ટ્રાન્સફર માટે

અરજી સાથે નામ ટ્રાન્સફર કરવા માટે સિટી સર્વેની પ્રમાણિત નકલ, જો મિલકત રજીસ્ટર્ડ કો.ઓ.હા.સોસાયટીમાં હોય તો પ્રેશન લેટર અને શેર ટ્રાન્સફરના ઠરાવની ચેરમેન અથવા સેક્ટરીની સહી સિક્કાવાળી પ્રમાણિત નકલ, અથવા રજીસ્ટર્ડ દસ્તાવેજ અથવા ઇન્ટેક્શની નકલ., અથવા કન્વેયન્સ ડિડની પ્રમાણિત નકલ જેના નામે મિલકત ટ્રાન્સફર કરવાની છે તેઓની અરજી ફોર્મના કોલમ નં.૮ માં મિલકત ખરીનાર બધાની સહી કરાવવી રજૂ કરવાથી કરી આપવામાં આવશે. આ મિલકતનો અરજી કર્યા તારીખ સુધીનો પૂરેપૂરો તમામ ટેક્સ ભરી પહોંચની પ્રમાણિત નકલ સાથે નિયત ફોર્મમાં અરજી કરવાની છે.

ક્રમાંક નં. ૨ થી ૧૦ ના દરેક ફોર્મની કિંમત રૂ.૨-૦૦ રાખવામાં આવેલ છે.

જાહેરનામાના અનુસંધાનમાં ખુનિસિપલ મિલકતવેરાના આકારણી અંગે વાંધા અરજી કરવા માટે

દર વર્ષે ખુનિસિપલ કોપોરેશન દ્વારા ટેક્સના બિલ ઈસ્યુ કરતા પહેલા જાહેરજનતા પોતાની મિલકતનો ટેક્સ કેટલો છે તે જાણી શકે તે માટે ૧૫ દિવસ સુધી એસેસમેન્ટ રજીસ્ટરો જોવા માટેની જાહેરાત બે વર્તમાનપત્રોમાં પ્રસિધ્ય કરવામાં આવે છે. નાગરિકો વિનામૂલ્યે આવી નોંધ જોઈ શકે છે, તેનો ઉતારો કરી શકે છે અને નોંધ કે ટેક્સ સામે કોઈ વાંધો હોય તો પુરાવા સાથે નિયત ફોર્મમાં નિયત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. વાંધા અરજીના નિકાલ માટે એપેલેટ ઓફિસર ઉપરોક્ત અરજીની સુનાવણી કરી નિકાલ કરશે. એપેલેટ ઓફિસરના હુકમથી સંતોષ ન હોય તો આવો હુકમ મળ્યાના ૧૫ દિવસની અંદર સ્મોલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. બિલ સામે ફરિયાદ કરી શકતી નથી.

ખાસ નોટિસ સામેની વાંધા અરજી અંગે

હ્યાત મિલકતમાં કોઈ વધારાના બાંધકામના સમયે કે મિલકતનો વપરાશ માલિક તાબેથી ભાડુઆત તાબે થાય કે રહેઠાણમાંથી બીનરહેઠાણમાં વપરાશ બીલાવવાના લીધે ચાલતો ટેક્સ વધારવાના સમયે કારણોની વિગત સાથે મિલકત ધારકને ખાસ નોટિસ આપવામાં આવે છે. સદરહુ નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં વાંધાના કારણો-પુરાવા સાથે વાંધા અરજી કરી શકાય અને અને આવી વાંધા અરજીનો નિકાલ જાહેરનામાના સંદર્ભમાં કરવામાં આવેલ વાંધા અરજીના નિકાલની જેમજ એપેલેટ ઓફિસર દ્વારા કરવામાં આવે છે.

મિલકત વપરાશ / પુનઃ વપરાશ સમયે કરવાની ફરજીયાત જાણ:

કોઈપણ નવી મિલકત કે જૂની બંધ મિલકતનો પુનઃ વપરાશ શરૂ કર્યાના ૧૫ દિવસમાં ખુનિસિપલ કોપોરેશનમાં બી.પી.એમ.સી. એક્ટના પરિશિષ્ટ એ ના ગ્રકરણ-૮ ના રૂલ ૫ હેઠળ જાણ કરવી ફરજીયાત છે. નિયત કરવામાં આવેલ રીકવીજીશન ફોર્મ ખુનિસિપલ કોપોરેશનની ઝોનલ કચેરીઓના ટેક્સ વિભાગમાંથી વિના મૂલ્યે મળી શકશે. સમયમર્યાદામાં મિલકતના વપરાશ કે મિલકતમાં થયેલ વધારાના બાંધકામ, બદલાયેલ ઉપયોગના પ્રકાર કે ભાડુઆત અંગે જાણ કરવામાં ન આવે તો આવી મિલકતોનો ટેક્સ, ટેક્સ ખાતા દ્વારા પુરાવાના અભાવે કરવામાં આવે છે અને બી.પી.એમ.સી. એક્ટ પરિશિષ્ટ-એ ના ગ્રકરણ ૮ ના રૂલ ૮(૩) ની જોગવાઈ મુજબ આવા ટેક્સ સામે વાંધો લેવાને મિલકતના માલિક અથવા ભોગવટો કરનારને પ્રતિબંધ નડશે.

## ● અરજી નિકાલની સમય મર્યાદા

તમામ પૂરાવાઓ અરજી સાથે આપેલા હોય અને નવી ગણતરી મુજબ પૂરેપૂરો ટેક્સ ભરપાઈ કરવામાં આવેલ હોય તો અરજનો નીચે જણાવેલ સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવશે.

અનુ. નંબર	અરજનો પ્રકાર	અરજીના નિકાલની સમય મર્યાદા
૧	બી.પી.એમ.સી. એકટની કલમ ૪૮૫/૧, રૂલ ૨૦ તથા સરક્યુલર નં. ૧૪ મુજબ મિલકતની આકારણી ધટાડવા બાબત	૧ માસ
૨	નવી મિલકતોનું એસેસમેન્ટ કરવા અગર તો જૂની મિલકત ભાડુઆત પાસેથી કરવામાં આવેલ ભાડાના વધારાને લઈ તેમજ વપરાશ ફેરફાર થયેલ હોઈ આકારણી રીવાઈજ કરવા	૧ માસ
૩	મિલકતના કળ્જેદારમાં ફેરફાર કરવા બાબત	૧૫ દિવસ
૪	મિલકતના ઉપયોગના પ્રકારમાં ફેરફાર	૧૫ દિવસ
૫	જમીનદોસ્ત થયેલ મિલકતના ટેક્સના બિલો રદ્કરવા	૧ માસ
૬	સમગ્ર મિલકતનું એક બિલ આવે છે તેના બીલે જગાના વપરાશ મુજબ આકારણીના ભાગલા પાડીને તે મુજબ ટેક્સ બિલ આપવા બાબત	૧ માસ
૭	એક જ મિલકતના બે બિલ આવતા હોય તો વધારાનું બિલ રદ કરવા	૧ માસ
૮	મિલકતના નામ ટ્રાન્સફર માટે	૧૫ દિવસ
૯	અન્ય-સામાન્ય અરજીઓ	૧૫ દિવસ
૧૦	મિલકત ખાલી / નોન યુઝ અંગે	વર્ષ પુરું થયા બાદ ૩૦ એપ્રિલ સુધી
૧૧	ચુ. વેલ્યુઅશન અપીલના ચુકાદાનો અમલ લેવા અંગે	૧૫ દિવસ


ઉપરોક્ત પ્રકારની અરજીઓના નિકાલ માટેની લધુતમ સમય મર્યાદા ખાતા દ્વારા નિયત કરવામાં આવેલ છે. જો ઉપરોક્ત સમય મર્યાદામાં અરજીનો નિકાલ ન થાય તો સંબંધિત જોનનાં ડેપ્યુટી એસેસર એન્ડ ટેક્સ કલેક્ટરનો રૂબરૂ સંપર્ક કમકાજનાદિવસોએ ઉ-૦૦ થી ૫-૦૦ માં કરવો.

બિલમાં નામ/ સરનામાં (સ્પેલીંગ) અંગેની ભૂલ માટે પૂરાવા સાથે સાઢા કાગળ ઉપર અરજી કરવાથી તે અંગેનો નિકાલ કરવામાં આવશે.

આવી અરજીઓ કરવા જાહેર જનતાની અનુકૂળતા માટે ખુબજ નજીવી કિમતે છાપેલા શોર્મ દફતર વિભાગ તથા દરેક જોન તથા દરેક સીવીક સેન્ટર ઉપરથી નાગરિકોને ઓફિસ સમયે વેચાણ આપવામાં આવે છે તેમજ ભરેલ શોર્મ કોઈપણ જોનની અરજી આપી શકે તેવું આયોજન કરવામાં આવેલ છે. નીચે મુજબના કેશ કલેક્શન કાઉન્ટરો રાખવામાં આવેલ છે.

બિલ મળ્યાના ૧૫ દિવસમાં જો બિલ ભરવામાં ન આવે તો ટેક્સ બીલમાં જણાવેલ રકમ તેમજ પાઇલા વર્ષની બાકી રકમ નિયમ મુજબ કાયદાકીય જરૂરી પગલાં લઈ દંડ સાથે વસુલ કરવામાં આવે છે.

(2) અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો:-



(3)

# કુન્ડાન મુખ્યમંત્રી

ઇન્સ્પોક્ટર (એસેસમેન્ટ, શીકવરી તથા મેડિચિન) ની કામગીરી (સીનીયર કલાક)

## ૧. શીકવરી:

- પ્રોપર્ટી ટેક્સની શીકવરી અંગે તબક્કાવાર કામગીરી થાય પરવાની છે.
- ૧.૧. વીલોની ચકાસણી કરવી, તેને વંગતી કરીયાઓનો નિકાલ કરવો.
  - ૧.૨. વાંધા અરજીવાળા બિલો અલગ કાઢી લેવા.
  - ૧.૩. વાંધા અરજી સિવાયના બીલો ઉપર જરૂરી સિક્કા લગાવવા.
  - ૧.૪. વાંધા અરજી સિવાયના બીલો નિયત સમય મર્યાદાના જે તે કરદાતાને મળે તે રીતે પહોંચાડવા.
  - ૧.૫. બીલના નાણાં ભરવાના છેલ્લી તારીખ પસાર થયા પછી બાકી પણ તૈયાર કરવા.
  - ૧.૬. બીલ છિંદુ થયા બાદ કરદાતા દ્વારા એ મેળવવામાં આઓ હોય તો તેની રીમાન્ડ રજાફટરે નોંધ કરવી અને શીકવરી સ્ટાફને તેની જાણ કરવી.
  - ૧.૭. પાર્ટ પેમેન્ટ માટે જ્યારે કરદાતા નાણા ભરવા આવે ત્યારે પાર્ટ પેમેન્ટ અંગેની ખાતાને નિયત કરેલ શીર્ષિયાં સ્વીપ લનાવી આપવી.
  - ૧.૮. પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા કરદાતા સામે શીકવરીના કંક પગલાં રૂપે છેલ્લી ચેતવણીના કાર્ડ લખવા, પાણીના કનેક્શન કાપવા, વોરંટ તૈયાર કરવા તથા તેને બજાવવાની કામગીરી કરવા.
  - ૧.૯. વોરંટ છિંદુ કર્યા બાદ જે કરદાતા પ્રોપર્ટી ટેક્સ ન ભરે તો તેની નિલક્ષતની હરાજીની કાર્યવાહી કરવાની થાય છે તે અંગે હરાજ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હરાજીની સેલ કન્ફર્મ સુધીની કાર્યવાહી કરવાની.
  - ૧.૧૦. વોરની શીકવરીના ચેક સ્વીકારવાયા વગર પરત આવે તેવા રીટર્ન ચેકની શીકવરીની કામગીરી તાકિંડ કરવી અને જે રીટર્ન ચેકની રીકવરી આવે તેમ ન હોય તો રીમાન્ડ રૂપે કરવાની જરૂરી મંજુરી મેળવવા તથા તે અંગે મંજુરી મલ્ય ડિમાન્ડ નોંધ રાજીવી અને તે મુજબનું કાંચુટર શીર્ષ ભરી કાંચુટર આપતે મોકલાવી આપવું.
  - ૧.૧૧. કરદાતાનો તરફથી કર ભરવા અંગે માંગવામાં આવેલ ઉપાની અરજી અંગે સક્ષમ મંજુરી મેળવી આપેલ હતા મુજબ સમયસર નાણાં વસુલ કરવા.
  - ૧.૧૨. શીકવરી માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગી.સુ. શ્રી સાથે તથા ઉપરી આવિકારી સાથે જે તે નિલક્ષતની શીકવરી માટે વોરિયાં જરૂરું.

## ૨. એસેસમેન્ટ:

- ગી.ડી.ઓ. ખાતેથી આવેલ બી.પુ.પરમીયાના આપારે, વિજિવન્સ શીપોર્ટના આપારે, ટેક્સ જનરલની અરજના આપારે, ભાડાકોડ કરવા અંગે, સ્થળ તપાસ દરમયાન આકારણી કરવા મોઅ નિલક્ષતની આકારણી અંગે, વેલુઅશન તથા એપેલટ ઓફિસરની રીમાન્ડસના અનુસંધાન વિ. અંગે જે નિલક્ષતની નવેસરથી આકારણી કરવાની થાય તેમાં તેમજ ચાલુ નિલક્ષતની આકારણી વધારવા અંગે નીચે મંજુરની કાર્યવાહી કરવાની છે.
- ૨.૧ જે તે નિલક્ષતની જગ્યા ગી.સુ.ને ભતાવવી તથા ગીસુ ની સુચના મુજબ જગ્યાના માપ લેવા.
  - ૨.૨ જે તે નિલક્ષતના રેકોર્ડિશન ફોર્મ તૈયાર કરી મકાન માલિક અગર કબજેદારને તેઓને મલ્યાની સહી લઈ આપવા.
  - ૨.૩ નિયત સમય મર્યાદામાં રેકોર્ડિશન ફોર્મ પરત આવે જરૂરી પુરાવા સાથે ફાઈલ તૈયાર કરી ગી.સુ.ને આકારણી કાર્યવાહી કરવા સાંપત્તિ.

newstaff

(4)

૨.૪ ડી.સુ. મારકતે કરવામાં આવેલ આકારથી અંગેની ખાસ નોટિસો તેમજ ચતુરજિય આકારથી દરમ્યાન વેલ્યુઅશન ગોકિસરો મારકતે આકારથીમાં કરવામાં આવેલ વાધારા અંગેની જે ખાસ નોટિસો આવે તે એક કરી જે તે કરદાતાને પડોયાંની કરવી અને તે મહ્યા અંગેની સહી લેવી.

### ૩. વાફીવટ:

૩.૧ આકારથી અંગેનું જાહેરનામું પરિદિધ રૂપી પહેલા એસેસમેન્ટ રજીસ્ટરની ડીમાન્ડ રજીસ્ટર સાથે મેળવતું અને ડીમાન્ડ રજીસ્ટર મુજબના આકારથી અંગેના તમામ છેલ્લામાં છેલ્લા સુધારા નોંધી એસેસમેન્ટ ખૂબ તૈયાર કરવી.

૩.૨ વેલ્યુઅશન વર્ષમાં વેલ્યુઅશન ખાતે ૨૬ રજીસ્ટર મોકલતા પહેલા તમામ સુધારા ૨૬ રજીસ્ટરમાં મૂકી જે તે ૨૬ રજીસ્ટરો વેલ્યુઅશન ખાતે પૂર્ણ પાડવી.

૩.૩ જાહેરનામા દરમ્યાન આવેલ કરદાતાને તેની નિલક્ષણ અંગેની તેને જોઈતી માહિતિ એસેસમેન્ટ જોઈ પૂરી પાડવી અને જરૂર પડે તેને ઉત્તારો કરવા હેવો.

૩.૪ જાહેરનામાની મુદ્દત દરમ્યાન અગેર ખાસ નોટીસના અનુયોધનમાં આવેલ વાધા અરજાઓના દાખલા ભરી ટેપાલબુકે ચકાવી એપેલેટ ખાતે સમયસર મોકલ્યી આપવા.

૩.૫ વાંપા અરજાઓનો નિકાલ કરી એપેલેટ પાતેથી આવેલ ડ.ર.ટાચ મુજબ ડીમાન્ડ રજીસ્ટરમાં અગર ભાંડાપત્રકે જરૂરી નોંધ રાખવી અને કરદાતાને સુધારેલું ટેકસનું બીલ બજાવતું તેમજ જ્યા જ્યા જરૂર હોય ત્યા સુધારા અંગેના કોમ્પ્યુટર સૌંચ ભરવા અને કોમ્પ્યુટર પાતે મોકલ્યી આપવા.

૩.૬ કોમ્પ્યુટર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીમાન્ડ રજીસ્ટરો બધાવી તેને પાછલા વર્ષના ડીમાન્ડ સાથે મેળવણી કરી, પાછલા વર્ષના ડીમાન્ડના તમામ સુધારા આવા છે? કે કે? તે એક કરવા અને જે સુધારા ન આવ્યા હોય તેના સુધારા મૂકી નવેસરથી કોમ્પ્યુટર કોર્મ ભરવા અને તે મુજબનું સુધારેલું બીલ કરદાતાને મોકલ્યુ.

૩.૭ વેલ્યુઅશન વર્ષ દરમ્યાન વેલ્યુઅશન ઓક્સિસરથી એ જે નવી વધ કરી હોય તેવી વધના નવા ટેનામેન્ટ નંબરનું કોમ્પ્યુટર કોર્ટિંગ કરતું અને કોર્ટિંગ કરેલા રજીસ્ટરો કોમ્પ્યુટર ખાતે મોકલ્યુ.

૩.૮ ગોપર્ટી ટેકસ સંબંધમાં આવતા નિવિષ અરજાઓનો નીચે જાણવા મુજબ નિકાલ કરવો.

૩.૮.૧ નામ ટ્રાન્સફર: (ટેકસ ટી.એસ.એફ.) ની અરજી અંગે જરૂરી મંજૂરી મેળવવા માટે જાઈલ તૈયાર કરી હોય સતતાની મંજૂરી મેળવવી.

૩.૮.૨ ટેકસ વેકન્ટ: (ખાલી અંગેનો અરજી): આ અંગેની અરજાઓમાં દર માસે સ્થળ તપાસ કરી જે તે નિલક્ષત ખરેખર ખાલી હોવા અંગે ખાલી કરવી. તેમજ માર્ચ માસમાં ૧૦૦૦ થી ૩૦૦૦ સુધીની આકારથીયાળી નિલક્ષત ડી.સુ.શ્રીને તેમજ રૂ.૩૦૦૦ થી ૭૫૮૦ની આકારથીયાળી નિલક્ષત આસ્ટ્રી. મેનેજર અગર ડે.એસેસર અને કલેક્ટરથીને બ્લાન્ડવી અને જે નિલક્ષતમાં ખાલીનું રીકડ મળતું હોય તેવી નિલક્ષત માટે જરૂરી મંજૂરી માંગી, રીકડની ગંભીરતાની કરાવી, ડીમાન્ડ નોંધ મુક્તી અને કોમ્પ્યુટર કોર્મ ભરવા.

૩.૮.૩ વાંપા અરજી: ગોપર્ટી ટેકસની આકારથી અંગે આવેલ વાંપા અરજાઓના દાખલા કોર્મ ભરી ડી.સુ. મારકતે એપેલેટ ખાતે મોકલ્યાં.

૩.૮.૪ ટેકસ એન.ડબલ્યુ.સી.આર. (નવા વોટર કોક્ષનાની અરજી અંગે) જે તે નિલક્ષતમાં પાણીનું નંબર કોક્ષન લેવા માટે પાણી ખાતાનું જે કોર્મ ભરવામાં આવે છે તે કોમ્બમાં વીક, સર્વેનંબર, સેન્સસ નંબર, માલિકનું નામ વિગ્રહ ડીમાન્ડ સાથે ચકાસી, આ નિલક્ષતનો પૂરેપૂરો ટેકસ વસુલ છે કે કેમ તે અંગેનું સટીક્વિક્ટ આપતું.

newstaff

- 3.7.4 ટેકસ જનરલ: ટેકસ જનરલની આવેલારણઓ અંગે રીમાન્ડ દાખલા ભરવા અને આવી અરજી અંગે યોગ્ય સત્તાની મંજુરી મળ્યેથી અરજદારને જીવક મોકલવો.
- 3.7.5 કોર્ટ મેટ્રે તથા વેલ્યુઅશન અપીલ તેમજ તેના જજમેન્ટના અમલ આપવાની કાર્યવાહી: કોર્ટ તરફથી આવેલ સમાન્સ મુજબની તેમજ મુનિ. વેલ્યુઅશન અપીલમાં મ્યુ.એડવોકેટ દારા માંગવામાં આવેલ માહિતી જરૂરી વિગતો સાથે તાઇટ તેથાર કરવી અને તે મ્યુ.એડવોકેટશ્રીને પહોંચાડવાની કામગીરી કરવી અને જરૂર પડ્યે કોર્ટમાં ધાજર રહેતું. કરદાતા તરફથી આકારણી અંગે સ્પેલ તોંક કોર્ટમાં દાખલ થયેલ વેલ્યુઅશન અપીલ અંગે મ્યુ.એડવોકેટશ્રીને રીમાન્ડ દાખલવાના હોર્ન ભરી ને. અંગેના તથા એપેલેટ ઓફિસરના કરાવાની નકલ તેમજ મ્યુ.એડવોકેટશ્રીને જે કોઈ માહિતીની જરૂર હોય તે પૂરી પાડવી. આકારણી અંગેના સ્પોલ તોંક કોર્ટના મુકદાનાં અમલ આપવાની કામગીરી કરવી. આ કામગીરી કરતી વખતે જે કોર્ટમાં મુનિશિપલ શીપરિશનને આર્થિક રીતે મુકશાની લોગવવી પડે તેમ હોય તેવા કોર્ટમાં તેવા જજમેન્ટો ઉપરી અધિકારીના ઘાન પર લાતી, જરૂર જ્ઞાય ત્યાં છાઈકોર્ટમાં અપીલ કરવાની કામગીરી કરવી અને છાઈકોર્ટના થયેલ રીટ પીઠીશન દરમાન તમામ માહિતી તેથાર કરી એડવોકેટશ્રીને જાણકારી આપવી. જે કોર્ટમાં અમલ આપવાનો થતો હોય તેવા કેસોમાં યોગ્ય સત્તાની જરૂરી મંજુરી મેળવવી તેમજ કરી યતા ટેકસની ગણતરી કરી, ટેકસ એકાઉન્ટ ખાતે એક કરાવવી અને ડીમાન્ડ તે અંગેની નોંધ મૂકવી.
- 3.8 રીંડના બીલો: વેલ્યુઅશન અપીલના મુકદાનાં અમલ આપવાથી તેમજ ભાતાની અરજણો નિકાલ થવાથી કરદાતાને જે રીંડ આપવાનું થાય તો તે અંગેની ગણતરી કરાવી રીંડનું બીલ બનાવી, પાસ કરાવવા ચીફ ઓફિચ ખાતે મોકલી આપવું.
- 3.9 એકાઉન્ટ અને ઓફિચ એફલેક્શન: પોતાના વોર્કની પાછળી બાટી, ચાલુ રીમાન્ડ, ચાલુ વર્ષની અને પાછળા વર્ષની વસુલાત વિગેરેના આકડાઓ તેથાર કરવા તેમજ ઓફિચ ખાતા મારફતે કાઢવામાં આવેલા વાંધાઓનો જરૂરી નિકાલ કરવો.
- 3.10 જનરલ:
- 3.10.1 ખાતાઓ માહિતીના સરકયુલરના જવાબો કરવા, ડિ.સુ.ને જરૂરી માહિતી પૂરી પાડવી.
  - 3.10.2 બોર્ડ તથા કમીટીમાં પૂર્ણાંશ સવાલોના જવાબો તેથાર કરવા માટે તેમજ બોર્ડમાં મૂકવામાં આવેલ દરમાસ્ત અંગેની માહિતી તેથાર કરવા માટે ડિ.સુ.ને જોઈની માહિતી પૂરી પાડવી.
  - 3.10.3 રૂલ-૨૦, સરકયુલર-૧૪, કલમ-૪૮૫ ડેટની અરજણોના નિકાલ અંગે રીમાન્ડ દાખલા ભરી, ફાઈલ તેમાર કરી મંજુરી મેળવવા ડિ.સુ.શ્રીને સોંપવી.
  - 3.10.4 વોર્કના મુખ્યમાનોનો તેના નિકાલ થયા બાદ દફતરે કરાવવી.
  - 3.10.5 અરજદારોની આવેલી કોઈપણ પ્રકારની અરજી સંબંધમાં મંજુરી મુજબ રીમાન્ડ રજીસ્ટરે સુધારા કરવા અને સુધારા મુજબના કાંપ્યુટરના કોર્મ ભરવા.
- આ ઉપરાત ડિવિઝનલ સુપ્રિન્ટેડન્ટશ્રી તથા ઉપરી અધિકારીશ્રી તરફથી જે કામગીરી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

newstaff

## ડિવિઝનલ સુપ્રિન્ટેન્ટ

૪

૧

### ૧. સુપરવીઝન:

ટેક્સ ભાતાના ડિવિઝનલ સુપ્રિન્ટેન્ટનીને તેને સોંપવામાં આવેલ બીટના વહીવારી અવિકારી છે. તેના હાથ નીચે જે તે બીટના ઈન્સ્પેક્ટર, ઓફિસ કલાર્ક, પટાવાળા, લુધાર, મજૂર ફરજ બજારે છે. આ દરેક કર્મચારીની કામગીરીનું સુપરવીઝન કરવાનું હોય છે. આ કર્મચારીઓ નિયમોત્ત સમયસર ફરજ પર આવે, તેઓની જગ્ગા ઉપર બજારે, તેઓ જે કામગીરી કરે તેની ૭૫૨ ટેખરેખ રાખવી અને જરૂર પર માર્ગદર્શન પૂર્વે પાપવાળી ફરજ છે જે તે કર્મચારીની કેજયુઅલ રજા ભરાવવી, કેજયુઅલ રજાનું પત્ર રાખવું, હાજરી ચેક કરવી તેમજ આ કર્મચારીની ડાયરી રખાવવી અને ડાયરી તપાસવાની કામગીરી છે.

### ૨. રીકવરી:

પ્રોપર્ટી ટેક્સની રીકવરી અંગે નીચે મુજબ તબક્કાવાર કામગીરી હાથ ધરવાની છે.

૨.૧ બીલોની ચકાસણી કરાવવી, તેને લગતી ફરીયાદીનો નિકાલ કરાવવા, વાંચા અરજીઓવાળા બીલો કંબાવી દેવા, બીલો ઉપર જરૂરી સિક્કા લગાડવા, બીલો વહેચાવવા.

૨.૨ બીલના નાણોં ભરવાની છેલ્લી તારીખ પસાર થયા પછી બાકી પત્રક તૈયાર કરાવવા.

૨.૩ બીલ ઈસ્યુ થયા બાદ કરદાતા દ્વારા રેટ મેળવવામાં આબો હોય તો તેની ડીમાન્ડ રજાસ્ટર નોંધ કરવી અને રીકવરી સ્ટેફને તેની જાણ કરાવવી.

૨.૪ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા કરદાતા સામે રીકવરીના કડક પગલાં રૂપે છેલ્લી ચેતવણીના કાર્ડ લખવા, પાણીના કનેક્શન કાપવા, વોરંટ તૈયાર કરવા તથા તેને બજાવવાની કામગીરી કરવી.

૨.૫ વોરંટ ઈસ્યુ કર્યા બાદ જે કરદાતા પ્રોપર્ટી ટેક્સ ન ભરે તો તેની નિલકતની હરાજીની કાર્યવાહી કરાવાની થાય છે તે અંગે હરાજ કરાવવાની કાર્યવાહી શરૂ કરી હરાજીની સેલ કન્ફર્મ સુધીની કાર્યવાહી કરાવવાની.

૨.૬ બીટની રીકવરીના ચેક સ્વીકારયા વગર પરત આવે તે અંગે રીટર્ન ચેકનું રજાસ્ટર મેઈન્ટેઇન કર્યું અને રીટર્ન ચેકની રીકવરીની કામગીરી તાકિંગ કરવી અને જે રીટર્ન ચેકની રીકવરી આવે તેમ ન હોય તો ડીમાન્ડ વધ કરાવાની જરૂરી મંજૂરી મેળવા તથા તે અંગે મંજૂરી મેળવી નોંધ રાખવી અને તે મુજબ કમ્પુટરમાં સુધારો કરાવવાની કાર્યવાહી કરાવવી.

૨.૭ પોતાની બીટના સ્ટાફ જેમ કે ઓફિસ કલાર્ક, ઈન્સ્પેક્ટર, લુધાર, મજૂર વિ.ની કામગીરીનું આપોજન કરવું અને રીકવરી સ્ટેફની કામગીરી ઉપર ટેખરેખ રાખવી.

૨.૮ રીકવરી અંગે નાણોં સ્વીકારવા માટે રાખવામાં આવેલ કેશ કાઉન્ટર સ્ટાફની વ્યવસ્થા ગોઠવવી અને આ સ્ટાફની કામગીરીનું ચેકિંગ કરવું.

૨.૯ કરદાતાનો તરફથી કર ભરવા અંગે માંગવામાં આવેલ હપ્તાની અરજ અંગે સંક્ષમ સત્તાની મંજૂરી મેળવી આપોલ હપ્તા મુજબ સમયસર નાણોં ભરાય તે ચેક કરવાનું છે.

૨.૧૦ એકટની કલમ ૧૪૦ મુજબ નિલકતના કલજેદારને નોટિસ આપી ભરવાનું થતું ભાહુ મુનિ. ટેક્સ પેટ જમા કરાવવાની નોટિસ પાઠવવાની કામગીરી કરવી.

### ૩. નિલકતની આકારકીની કામગીરી:

૩.૧. મારકત તેની બીટમાં આવેલી નિલકતો અંગે જ્ઞાનેલ કારણોસર આકારકી કરવામાં આવે છે.

૩.૨. વિજિલન્સ ઓફિસરના રીપોર્ટના આખારે

૩.૩. વી.રી.નો. ખાતેથા આવેલ બી.પુ.પરમીશનની નકલ ઉપરથી

૩.૪. ઈન્સ્પેક્ટર તરફથી આપવામાં આવેલ કોર્ટ ઉપરથી તથા કરવામાં આવેલ રિપોર્ટના આધારે

newstaff

૪. ખાતામાં આપેલ ટેક્સ જનરલની અરજીઓ જેવી કે ભાડાકોડ કરવા, નવેસરથી આકારથી કરવા વિ.
૫. સ્થળ તપાસમાં ચેકિંગ દરખાંન આકારથી રીવાઇઝ કરવા યોગ્ય હોય તેવી બાબત ધ્યાનમાં આવતી
૬. વેલ્યુઅશેન તથા એપેલેટ ઓક્સિસરની રીમાર્કિંગ ઉપરથી
૭. આ ઉપરાંત એકટની જોગવાઈઓ મુજબ મંડાનોની આકારથી જરૂરી તપાસ બાદ કરવી.
- આકારથી કરતી વખતે નીચેની વિગતો ધ્યાનમાં રાખવાની હોય છે.
- જે તે મિલકતનો બાંધકામનો પ્રકાર, બાંધકામ કર્યા વર્ષમાં થયું છે, બાંધકામ કર્યા વિસ્તારમાં આવ્યું છે, બાંધકામનો ઉપયોગ, તેનો પ્રકાર, મિલકતના કબજેદાર-ભાડુઅત કે માલિક છે આ અંગેના પુરાવા, આજુબાજુ ઉપજતુ ખાહુધાનમાં લેવું આ બધી પરિસ્થિત ધ્યાનમાં લઈને જે તે મિલકતનું ઉપજ શક્તું ભાડું નક્કી કરવાની હોય છે.
૮. વાંધા અરજીઓ અંગેની કાર્યવાહી:
- વાંધા અરજીઓ સ્વીકારવાની વયસ્થા કરવાની તથા આપેલ વાંધા અરજીઓના ડીમાન્ડ દાખલા ભરાવીને વાંધા અરજીઓ એપેલેટ ખાતે મોકલવાની વયસ્થા કરવાની છે. એપેલેટ ઓક્સિસર વાંધા અરજીઓના નિકાલ કરીને જે આકારથી ઠરાવે છે તે આકારથીના સુધારા દોર્ભ તથા હા.ટા.ટા.વાંધ મોકલી આપવામાં આવે છે તે મુજબ ડીમાન્ડ નોંધ કરાવવાની હોય છે. ડીમાન્ડ નોંધ રખાવ્યા બાદ તેના બીલો તૈપાર કરાવવા અગર તો બીલો જે કામ્પુટરમાં બનીને આવી ગયા હોય તો જરૂરી સુધારો બીલ. ઉપર તથા ડીમાન્ડ કરાવીને તે બીલ જે તે કરદાતાને પહોંચાડવાની કામગીરી કરાવવાની છે.
૯. પ્રોપર્ટી ટેક્સ સંબંધમાં આવતી વિવિધ અરજીઓનો નિકાલ કરવો:
- ટેક્સ ખાતામાં આવતી અરજીઓને નીચે મુજબ વર્ગીકરણ પાડવામાં આપેલ છે.
- |                         |   |
|-------------------------|---|
| ૧. ટેક્સ ટી.એસ.એફ.      | -નામ ટ્રાન્સફર  |
| ૨. ટેક્સ વેકેન્ટ        | -ખાલી જગાની અરજી  |
| ૩. ટેક્સસ કમ્પ્લેન      | -વાંધા અરજી   |
| ૪. ટેક્સ-એન્ડબલ્યુસીઆર- | -નતુ વોટર કેકશન   |
| ૫. ટેક્સ જનરલ           | -સરકારખર-૧૪, ઇન-૨૦, કલમ-૪૮૫, હુલીકેશન આકારથી કર્મ કરવા, બીલો એકત્ર કરવાની અરજી અને કરવાની અરજી અરજીના અને કબજેદાર તથા ઉપયોગનો પ્રકાર ફેરફાર |
| ૬. ટેક્સ જફ્જનેન્ટ      | -વેલ્યુઅશેન અપીલના ચુકાદાનો અમલ   |
- ૫.૧ નામ ટ્રાન્સફર: ટેક્સ ટી.એસ.એફ.ની અરજી મિલકતાનું વેચાણ થવાથી મિલકત ખરીદનાર વ્યક્તિનું ચુનિસિપલ કોર્પોરિશના પ્રોપર્ટી રંખસ્ટરમાં પોતાનું નામ દાખલ કરવા નિયત કોમેન્ટ માહિતી સાથે અરજી આપે છે. આ અંગેના નામ ટ્રાન્સફરની જરૂરી કાર્યવાહી કરી યોગ્ય તે સત્તાની મંજૂરી મેળવવાની તથા આ કાર્યવાહી સમયસર થાય અને કોઈ ફીયાદ ન રહેતે જોવાની જવાબદારી ડી.સુ.શ્રીની છે.
- ૫.૨ ટેક્સ વેકેન્ટ: (ખાલી અંગેની અરજી): કરદાતા દ્વારા પોતાની મિલકત કોઈપણ પ્રકારના ઉપયોગ વગર ખાલી છે તે અંગેની અરજી જરી તપાસ માટે ઇન્સ્પેક્ટરને આપવામાં આવે છે. જે મિલકતની આકારથી રૂ.૧૦૦૦ થી રૂ.૩૦૦૦ રૂથી હોય તેવી મિલકતોની જગાઓ વર્ષના અંતે ડી.સુ.શ્રીને સ્થળ તપાસ માટે માર્ક માસમાં બતાવવામાં આવે છે અને રૂ.૩૦૦૦ વી ઉપરની આકારથી હોય તેવી મિલકતો જે તે વિભાગના આસ્પિ.મેનેજર, ડે.એસેક્સર અને કલેક્ટર અથવા એસેક્સર અને ટેક્સ કલેક્ટરને વર્ષના અંતે સ્થળ તપાસમાં બતાવવામાં આવે છે. ઇન્સ્પેક્ટર ખાલીની જગાની નિયમિત સ્થળ તપાસ કરે છે કે કેમ? તેની ચકાસથી કરવી.

newstaff

(5)

પ.૩ ટેકસ કમ્પેનીનાં: (વાંચા અરજી): ગ્રોપર્ટીની આકારથી અંગે કરવામાં આવેલ અરજણના નિકાલની કામગીરી એપેલેટ ઓફિસર મારકતે કરવામાં આવે છે. પરંતુ એપેલેટ ઓફિસરશીનો નિર્ણય લેવા માટે જે માહિતી પૂરી પાડવાની છે તે કામગીરી હી.સુ. મારકતે પૂરી પાડવામાં આવે છે જે અંગે આંગણ ઉપર વિગતે જણાપેલ છે.

પ.૪ ટેકસ (એનડબ્લ્યુસીઆર) નવા વોટર કનેક્શનની અરજી: ગ્રોપર્ટી ટેકસના કરદાતાઓ દ્વારા નંતુ વોટર કનેક્શન લેવા માટે પણી ખાતે શીર્ષ ભરે છે તેમાં જે તે ટેનામેનના સર્વ નંબર, સેન્સસ નંબરની ચકાસણી કરવી અને આ અંગેની અરજી કર્યા સુધીના વર્ષનો ટેકસ પૂરેપૂરો વસુલ આવેલ છે કે કેમ? તેનું સાટિફિકેટ આપવાનું હોય છે. આ કામગીરી ઈન્સ્પેક્ટર ડીમાન્ડ ઉપર ખાત્રી કરી લાખી જણાપે છે તેના ઉપર હી.સુ. સહી કરે છે.

પ.૫ ટેકસ જનરલ: ટેકસ જનરલની આવેલ અરજણાઓ અંગે ઓફિસ કલાર્ક મારકતે ડીમાન્ડ દાખલા ભરાવવાની કામગીરી કરાવવામાં આવે છે ત્યાબાદ હી.સુ. ને સાથે રાખીને જે તે અરજી સંબંધમાં સ્થળ તપાસ કરવી. સ્થળ તપાસ વખતે જે તે જગ્યાનું ટેક્સ મુજબનું માપ છે કે કેમ? જગ્યાના ઉપોગનો મ્યકાર રેક્રૂ મુજબ છે કે કેમ? જગ્યાના કબજેદાર અંગેની માહિતી- તેઓ માલિક ભાડાચાત કે અન્ય છે તેની વિગત, માલિક હોય તો માલિકીના પુરાવા તપાસથી, કબજેદાર તરીકે રેશનાંગ કરી, ગેસ કનેક્શન, ગુમાસ્તાપારા લાપસસ્ન્સ, ટેલાફોન બીલ વિગેરે પુરાવા તપાસવાની કામગીરી હોય છે. આમ ટેકસ જનરલની આવેલી અરજણનો અમલ આપવામાં જરૂરી હોય તેવા દસ્તાવેજ અસલ જેવા અને તેની નકલ સામેલ રાખવી ત્યારબાદ સક્ષમ સત્તાની મંજૂરી માંગવામાં આવે છે. આ અંગેની મંજૂરી મલ્યા બાદ અરજદારને સમયસર જીવક મળે તેવી વ્યવસા કરવાની હોય છે અને ટેકસના ડીમાન્ડ રજીસ્ટર જરૂરી નોંધ રખાવવાની અને ક્રમયુટરમાં જરૂરી સુધારા કરાવવા તજવીજ કરવાની હોય છે. સામાન્ય કરની માફી અંગે આવતી અરજણાઓ અંગે સ્થળ તપાસ કરીને, અરજી સંબંધમાં છેલ્લા ત્રણ વર્ષના ઓફિચિયલ બેરીટેબલ ટ્રસ્ટ એકટ હેઠળ રજીસ્ટર થયા અંગેનું સર્ટી.ની નકલ, ઈન્કમટેક્ષ માફી અંગેના સર્ટી.ની નકલ વિગેરે પુરાવા તપાસી સક્ષમ સત્તાની મંજૂરી માંગવામાં આવે છે.

પ.૬ કોર્ટ મેટર તથા વેલ્યુએશન અપીલ: કોર્ટ તરફથી આવેલ સમન્સ મુજબની માહિતી તૈયાર કરાવી અને કોર્ટમાં હાજર રહેવાની કાર્યવાહી કરવી, કરાવવી.

કરદાતા તરફથી આકારણી અંગે સ્મોલ કોર્ટમાં દાખલ થયેલ વેલ્યુએશન અપીલ અંગે મુફ એડવોકેટશીને ડીમાન્ડ દાખલાના શીર્ષ ભરાવી મોકલી આપવા. વે.ઓ.ના ટ્રેવન્ની નકલ તથા એપેલેટ ઓફિસરના ટ્રેવન્ની નકલ તથા વકીલને જરૂરી હોય તેવા પુરાવા અને માહિતી આપવાની કાર્યવાહી કરવી. કોર્ટના ચુકાદાના અમલ આપવવાની કામગીરી ઈન્સ્પેક્ટર મારકતે કરાવવી. સ્મોલ કોર્ટ કોર્ટના જરૂરેનું કે જે કોર્ટમાં મુનિસિપલ ક્રોપરિશનને આર્થિક રીતે ગુકાણની ભોગવવી પરે તેમ હોય તેવા કેરોમાં તેવા જરૂરેનો ઉપરી અપિકારીના ધ્યાન પર લાવવા અને જરૂર જણાય તાં દાઈકોર્ટમાં અપીલ કરવાની કાર્યવાહી કરાવવી. દાઈકોર્ટમાં થયેલ અપીલ સીટ પીટીશન અંગે જરૂરી તમામ માહિતી તૈયાર કરાવીને એડવોકેટશીને જાણકારી આપવી, માહિતી આપવી વિગેરે.

#### ૬. ક્રમયુટરમાં સુધારો કરાવવાની કામગીરી:

વર્ષ દરમાને ટેકસ ડીમાન્ડ થયેલ સુધાર જેવા કે મદાનમાલિકના નામમાં ફેરફાર, સરનામામાં ફેરફાર, આકારથીના ફેરફાર, સર્વ નંબર, સેન્સસ નંબરમાં ફેરફાર, ખેટ એકગ કરવી, ભાડુઆત પોતે મકાને જનીએ, ભાડુઆત બદલાય, વપરાશ બદલાય હોય, કમી કરવાના હોય વિગેરે માટે જે તે મારકતે ટેકસ રેક્રૂમાં ક્રમયુટરમાં સુધારો કરાવવા માટેના શીર્ષ સમયસર મોકલવાની વ્યવસા કરવાની છે. આ કામગીરી પણી મહત્વની છે તેમાં જો ખાની રહી હોય તો ડીમાન્ડ રજીસ્ટર, બીલ, બાકી પત્રક વિગેરે અનેક આનુસારી પત્રાની જીલ ચાલુ રહેવા પામે છે. ઓફિસ કલાર્ક / વોર્ડ ઈન્સ્પેક્ટર ક્રમયુટર સુધોરાના શીર્ષ ભરેલ છે તેમાં જે તે મંજૂરીની ફાઈલો સાથે ચકાસણી કરવી જોઈએ અને દરેક શીર્ષમાં હી.સુ. શીએ સહી કરવાની છે.

#### ૭. જાહેરનામાની કામગીરી:

newstaff

એસેસમેન્ટ રજીસ્ટરમાં હેલ્વા પણ મુપારાઓ નોંધીને તેને જાહેરનામાની તારીખ પહેલા અપોટ કરાવવાની કામગીરી કરાવવાની હોય છે અને રજીસ્ટર ઉપર જરૂરી ચલીસિકકા કરવીને સાંસ્કૃતિક આપવાની છે. જાહેરનામું પ્રશિલ થયેલી કરદાતાઓ પોતાની નિલકતોનું એસેસમેન્ટ શું છે? તે જોવા માટે આવે ત્યારે તેઓને એસેસમેન્ટ રજીસ્ટરો બતાવવાની વલસ્થા ગોઠવવાની હોય છે.

૮. એકાઉન્ટ અને એડિટ ઓફિસરના:

પોતાના બીટાંના આવેલ વોર્કની પાછળી બાકી, ચાલુ રીમાન્ડ, ચાલુ રીર્ન્ની અને પાછળા રીર્ન્ની વહુલાત વિગેરેના આંકડાઓ તૈયાર કરવા, હિસાબોની મેળવણી કરવી- કરાવવી તેમજ ઓડિટ માતા મારફતે કઢવવાના આવેલ વાપારનું વ્યવસ્થિત પત્રક રાખતું અને તેનો જરૂરી નિકાલ કરાવવો.

૯. જનરલ કામગીરી:

૧. ભાતાડિય માહિતીના સરકુલરના જવાબો કરવા.

૨. શોર્ડ તથા કમીશીએં પૂછાયેલ સવાલોના જવાબો તૈયાર કરવા માટે તેમજ બોર્ડમા મૂકવામાં આવેલ દરખાસ્ત અંગેની માહિતી તૈયાર કરવી.

૩. રૂલ-૨૦, સરકુલર-૧૪, કલમ-૪૮૫ હેઠળની અરજાઓના અલગ પત્રક રાખવા.

બીટાના તુમારોને તેમાં નિકાલ થયા ભાદ દસ્તરે કરાવવી.

આ ઉપરાંત ઉપરી અધિકારી તરફથી જે કામગીરી રોપવામાં આવે તે કામગીરી કરવી- કરાવવી તથા પોતાના તાબા હેડલ્યુના કર્મચારીઓને કામગીરી અંગે માર્ગદર્શન આપતું.

પોતાની બીટાના તારીઝ, રોજમેળ, પોસ્ટેજ એકાઉન્ટ, રેવન્યુ રજીસ્ટર વગેરે જે તે સ્ટાફ તરફથી નિયમિત તૈયાર થાય છે કે કેમ? તે અંગેની દેખરેખ રાખી કામ નિયમિત કરાવતું. બજેટ અંગ માહિતી તૈયાર કરવા માટે જરૂરી માહિતી પોતાના સ્ટાફ પારે તૈયાર કરાવવી.

### **(૩) નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતી:-**

ભુનિ.ટેક્સના નીતિ-નિયમો જોગવાઈ તથા થયેલ પાવર્સ ટેલીગેશન મુજબ જે-તે સત્તાધિકારે દ્વારા નિર્ણય લેવામાં આવે છે. જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે.

### **(૪) કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો:-**

કરદાતા દ્વારા ભુનિ.ટેક્સને લગતી આવેલ અરજીઓનો ટેક્સના નીતિ-નિયમો, ધારા-ધોરણો, પરિપત્ર વખતોવખત સમયમર્યાદા માટે અમલી બનતી ઈન્સેન્ટીવ સ્કીમ મુજબ સક્ષમ સત્તાની મંજુરી મેળવી નિકાલ કરવામાં આવે છે. જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે.

### **(૫) કાર્યો બજાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમો**

ટેક્સ ખાતા દ્વારા થયેલ પરિપત્ર, નવી ફોર્મુલા ટેક્સ પદ્ધતિના નીતિ-નિયમો, સુચનાત્મક આદેશો જે વેબસાઈટ ઉપર પ્રસિધ્ય કરવામાં આવેલ છે. જે મુજબ કરદાતાઓની અરજીઓનો નીતિ-નિયમોનુસાર નિકાલ કરવામાં આવે છે.

#### **સીટી સિવિક સેન્ટરની યાદી**

અ.નં	ઝોન	સીટી સિવિક સેન્ટર	એડ્રેસ	ફોન નંબર
૧	પાંચિંમ	લો ગાર્ડન	ગુજરાત લો સોસાયટીના મુખ્ય દરવાજા સામે, એલીસબ્રીજ, અમ-૩૮૦૦૦૬	૨૬૫૬૦૭૨૭ ૨૬૪૦૫૮૦૫
૨	પાંચિંમ	ઉર્માનપુરા	ડો.રમણભાઈ પટેલ ભવન, ઉર્માનપુરા ચાર રસ્તા, આશ્રમરોડ, અમદાવાદ ૩૮૦૦૧૩	૨૭૫૫૭૦૪૮ ૨૭૫૫૧૮૬૫
૩	પાંચિંમ	વાસણા	વાસણા સીટી સિવિક સેન્ટર, સ્વીમાંગ પુલ બીલ્ડિંગ, ગૌંઠાવરી ફ્લેટની સામે, વાસણા	૩૦૮૧૦૨૪૧
૪	પાંચિંમ	નવાવાડજ	નવાવાડજ મસ્ટર ઓફિસ, નવાવાડજ સર્કલ, નવાવાડજ	૨૭૬૪૦૨૬૬
૫	પાંચિંમ	ધરણીધર	કે.કે.શાસ્ત્રી વાંચનાલય, ધરણીધર દેરાસર સામે	૨૬૬૦૮૦૨૧
૬	પાંચિંમ	ગાંધીગ્રામ	ગાંધીગ્રામ સબજોનલ ઓફિસ, હિંમતલાલ પાર્ક સામે, આજાદ સોસાયટી	૨૬૭૬૦૨૪૩
૭	પાંચિંમ	સરદાર પટેલ સ્ટેડીયમ	પંચશીલ સોસાયટી પાસે, નારણપુરા કોસ્ટિંગ, નારણપુરા	
૮	પાંચિંમ	નારણપુરા	કામેશ્વર મહાદેવ પાસે, નારણપુરા	
૯	પાંચિંમ	સાબરમતી	સાબરમતી સબજોનલ ઓફિસ, ટોરેન્ટ પાવર	૨૭૫૭૦૮૧૦

૧૦	પાંચથ્રમ	ચાંદખેડા	જુની નગરપાલિકા ઓફિસ, ચાંદખેડા ગામ	૨૨૪૨૦૮૮૨ ૨૩૨૯૬૦૫૮
૧૧	ઉત્તર	નરોડા	રાજ્ય ગાંધી ભવન, નરોડા રોડ, મેઝ્કો ચાર રસ્તા પાસે, અમદાવાદ-૩૮૦૦૨૫	૨૨૮૪૪૬૪૨ ૨૨૮૦૩૩૮૯
૧૨	ઉત્તર	નરોડા-મુઠીયા	નરોડા મુઠીયા વોર્ડ ઓફિસ	૨૨૮૧૧૨૩૧
૧૩	ઉત્તર	સરદારનગર	સરદારનગર લાયબ્રેરી ભવન, સરદારનગર પોલીસ સ્ટેશન પાસે	૨૨૮૬૨૦૪૪
૧૪	ઉત્તર	સરસપુર	સરસપુર બાલભવન, કે.કે.આંખની હોસ્પિટલ પાસે, સરસપુર	૨૨૧૩૮૦૯૩
૧૫	ઉત્તર	કુલેરનગર	સી વોર્ડ, પાડીની ટાંકી પાસે, સરદારગ્રામ રેલ્વે સ્ટેશન સામે, કુલેરનગર	
૧૬	દક્ષિણ	રામબાગ	મ્યુ.બાલભવન, મહિનગર ફાયર સ્ટેશનની સામે, રામબાગ, મહિનગર, અમદાવાદ-૮	૨૫૪૬૬૩૨૮ ૨૫૪૫૩૮૦૬
૧૭	દક્ષિણ	ઈસનપુર	ઈસનપુર વોર્ડ ઓફિસ	૨૫૩૮૨૧૬૪
૧૮	દક્ષિણ	બાગેફિરદોશ	બાગેફિરદોશ વોર્ડ ઓફિસ	૨૫૮૫૪૦૯૬
૧૯	દક્ષિણ	કંકરીયા	મ્યુનિ.સ્કુલ પાસે, પારસી અગ્રીયારી પાસે, વેદ માટ્રિક્યુલિયારી રોડ, કંકરીયા	
૨૦	દક્ષિણ	ઘોડાસર	નવા દાણીલીમાડા વોર્ડ ઓફિસ, ઘોડાસર	
૨૧	દક્ષિણ	વટવા	વટવા ગામ	
૨૨	પૂર્વ	રખિયાલ	વિમળભાઈ મ્યુ. લાયબ્રેરી ભવન, રખિયાલ ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૨૧	૨૨૭૩૩૨૩૦ ૨૨૭૭૧૬૮૮
૨૩	પૂર્વ	ખોખરા	ખોખરા સર્કલ, રોકડીયા હનુમાનની બાજુમાં, ખોખરા	૨૨૭૪૮૦૮૧
૨૪	પૂર્વ	રાજપુર	રાજપુર સબ ઝોનલ ઓફિસ, ચુકુરીયા મહાદેવ પાસે, બળીયાકાઢ રોડ	૨૨૭૪૦૨૦૫
૨૫	પૂર્વ	ભાઈપુરા	ભાઈપુરા વોર્ડ ઓફિસ, જુના એ.એમ.ટી.એસ તેપોની અંદર, હાટકેશ્વર સી.ટી.એમ. રોડ	૨૫૮૫૨૫૪૪
૨૬	પૂર્વ	ગોમતીપુર	ગોમતીપુર વોર્ડ ઓફિસ, મ્યુનિ.બાલભવન, ગોમતીપુર દરવાજા સામે,	૨૨૭૪૦૭૬૬
૨૭	પૂર્વ	નિકોલ	નવુ લાયબ્રેરી બિલ્ડિંગ, કિશ્ચા ટ્યુબવેલ સામે, નિકોલ	૨૨૭૦૦૧૬૦
૨૮	પૂર્વ	અમરાઈવાડી	અમરાઈવાડી સબઝોનલ ઓફિસ, માથુર માસ્તર ચાર રસ્તા પાસે, અમરાઈવાડી	૨૨૭૪૨૮૩૮
૨૯	પૂર્વ	બાપુનગર	ગાયત્રીમંદિર પાછળ, બાપુનગર	
૩૦	પૂર્વ	વસ્ત્રાલ	જુની નગરપાલીકા ઓફિસ, અજ્ય ટેનામેન્ટ વિભાગ પ ની બાજુમાં, વસ્ત્રાલ રોડ	

૩૧	મધ્ય	રીલીફ રોડ	રૂપમ સિનેમા સામે, રીલીફરોડ, અમદાવાદ	૩૨૮૮૧૫૪૮ ૨૨૧૭૧૦૩૪
૩૨	મધ્ય	ગિરધરનગર	ગિરધરનગર વોર્ડ ઓફિસ, ગિરધરનગર,	૩૨૮૮૧૨૪૯ ૨૫૬૨૬૪૫૪
૩૩	મધ્ય	દુધેશ્વર	મ્યુ.બાલ ભવન, લાલાકાડા હોલ પાસે, દુધેશ્વર	
૩૪	મધ્ય	જમાલપુર	જે.પી.સ્ટોર, એ.એમ.ટી.એસ. સ્ટાફ કવાર્ટ્સ સામે, જમાલપુર	
૩૫	મધ્ય	દરીયાપુર	કુટી મસ્તિષ્ણ પાસે, રૂપાપરી પોળ, દરીયાપુર દરવાજા, દરીયાપુર	
૩૬	મધ્ય	શાહપુર	શાહપુર વોર્ડ ઓફિસ, બાપુ સૃતિકુંજ શાહપુર ચાર રસ્તા પાસે,	
૩૭	મધ્ય	ખાડીયા	જુના આંગડીયા નાકા, મહિપતરામ આશ્રમ પાસે, રાયપુર	
૩૮	નવા પ.જોન	બોડકદેવ	બોડકદેવ સીટી સીવીક સેન્ટર, અતિથિ	૩૨૮૮૧૩૮૨
૩૯	નવા પ.જોન	વેજલપુર	વેજલપુર સીટીસીવીક સેન્ટર, જલતરંત પોલીસ સ્ટેશન પાસે, જલતરંગ બસ સ્ટેન્ડ અમદાવાદ	૨૬૮૧૩૨૭૮ ૨૮૮૧૩૩૭૮ ૩૨૫૨૦૮૨૮
૪૦	નવા પ.જોન	રાણીપ	રાણીપ સીટી સીવીક સેન્ટર, જુના નગર પાલિકા બીલીંગ, મહેશ પાર્ટી પ્લોટની સામે	૨૭૫૨૩૭૭૦
૪૧	નવા પ.જોન	ચાંદલોડીયા	ચાંદલોડીયા સીટી સીવીક સેન્ટર, ચાંદલોડીયા	૩૨૫૨૦૮૮૨
૪૨	નવા પ.જોન	વસ્ત્રાપુર	વસ્ત્રાપુર નગરપાલીકા ઓફિસ, વસ્ત્રાપુર ગામ	૩૨૫૦૬૦૦૨
૪૩	નવા પ.જોન	સરખેજ	સરખેજ વોર્ડ ઓફિસ, જુની નગરપાલીકા ઓફિસ, પાણીની ટાંકી પાસે, સરખેજ	
૪૪	નવા પ.જોન	કાળી	કાળી વોર્ડ ઓફિસ, કાળી ગામ, દિવ્યવીજ્ય પોસ્ટ ઓફિસ	૨૭૫૨૩૩૩૮
૪૫	નવા પ.જોન	ઘાટલોડીયા	ઘાટલોડીયા વોર્ડ ઓફિસ, ચાણકયપુરી બ્રિજ નીચે, ઘાટલોડીયા	૩૨૫૨૦૮૮૦
૪૬	નવા પ.જોન	જોધપુર	જુની નગરપાલીકા ઓફિસ, રામજ મંદિર પાસે, જોધપુર ગામ,	૨૬૮૨૪૫૩૩

### ટેક્ષ કલેક્શન સેન્ટર્સ

૧	મધ્ય	દાખાપીઠ	મ્યુનિ.કોર્પો. કંપાઉન્ડ, સરદાર પટેલ ભવન, દાખાપીઠ	૨૫૩૫૫૩૭૮
૨	નવા પ.જોન	મેમનગર	મેમનગર નગરપાલીકા ઓફિસ, માનવમંદિર પાસે	૨૭૪૬૦૬૧૭
૩	પૂર્વ	વિરાટનગર	વિરાટનગર ઝોનલ ઓફિસ,	૩૨૮૮૧૨૪૩
૪	પશ્ચિમ	આર.ટી.ઓ લીકલ ટેક્સ કલેક્શન સેન્ટર	સુભાષબ્રિજ સર્કલ પાસે,	

## મ્યુનિસિપલ પ્રોપરી ટેક્સના કર દરની નવી ફોર્મ્યુલા મુજબ માહિતી

(અમલ તા. ૧-૪-૨૦૦૧)

### સામાન્યવેરાની ગણત્રીની ફોર્મ્યુલા

સામાન્યવેરો = વાર્ષિક દર  $\times$  મિલકતનું ક્ષેત્રફળ  $\times$  ( ફેક્ટર:૧  $\times$  ફેક્ટર:૨  $\times$  ફેક્ટર:૩  $\times$  ફેક્ટર:૪ )

#### વાર્ષિક દર :

ઉપરોક્ત ફોર્મ્યુલામાં મિલકતનો વાર્ષિકદર ચો.મીટર દીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે બજેટ મંજૂર કરતી વખતે જાહેર કરશે અને દર નક્કી કરતી વખતે કોર્પોરેશને આગામી વર્ષ દરમ્યાન કોર્પોરેશનની નાણાંકિય જરૂરિયાતો લક્ષમાં લેશે.

#### મિલકતનું ક્ષેત્રફળ :

મિલકતનું ક્ષેત્રફળ આકારણી હેઠળની મિલકતના કારપેટ એરીયા ઉપરથી નક્કી કરવામાં આવશે. કારપેટ એરીયા ગણત્રી વખતે મિલકતની બાહ્ય અને આંતરિક દિવાલો હેઠળના ક્ષેત્રફળ સિવાયનું મિલકતનું તમામ ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહેશે.

વર્ષ ૨૦૧૩/૨૦૧૪ થી રહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી.વાર્ષિક દર રૂ.૧૬/- અને બિનરહેઠાણની મિલકતો માટેનો પ્રતિ ચો.મી. વાર્ષિક દર રૂ.૨૮/- નક્કી કરવામાં આવેલ છે.

#### ફેક્ટરના પ્રકાર અને ફેક્ટર લાગુ પાડવાની પદ્ધતિ

##### ફેક્ટર -૧ : સ્થળ પરિસ્થિતિ (Location) અંગેનો ફેક્ટર

અમદાવાદ શહેરનો કેટલોક વિસ્તાર સમૃદ્ધ છે, કેટલોક મધ્યમ કક્ષાનો છે અને કેટલાક વિસ્તારમાં ગરીબ પ્રજા રહે છે તેથી અલગ અલગ વિસ્તારની સમૃદ્ધિને લક્ષમાં લઈને સ્થળ સ્થિતિ અંગે ફેક્ટર લાગુ પાડવાના રહે છે તેથી પ્રવર્તમાન જમીનની કિંમત પરથી (અ) સમૃદ્ધ વિસ્તાર (બ) સારો વિસ્તાર (ક) મધ્યમ વિસ્તાર (ડ) નભળો વિસ્તાર એમ ચાર વિભાગ પાડેલ છે.

રહેઠાણ ની મિલકતો માટે	અવયવ
સમૃદ્ધ વિસ્તાર	૧.૬૦
સારો વિસ્તાર	૧.૧૦
મધ્યમ વિસ્તાર	૦.૬૦
નભળો વિસ્તાર	૦.૬૦

બિનરહેઠાણની મિલકતનો માટે વિસ્તારનું વિભાજન વધુ વાણિજ્ય શક્યતાઓ ધ્યાનમાં રાખીને કરેલ છે. સારી વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવનો દર ઉચ્ચો રાખવામાં આવેલ છે જ્યારે નભળા વાણિજ્ય શક્યતાવાળા વિસ્તારનો અવયવનો દર નીચો રાખવામાં આવેલ છે. આ અવયવોની કિંમત નીચે મુજબ રાખેલ છે.

બિનરહેઠાણ ની મિલકતો માટે	અવયવ
ખૂબ જ સારી	૧.૬૦
સારી	૧.૧૦
મધ્યમ	૦.૬૦
નભળી	૦.૬૦

રાજ્ય સરકારના સ્ટેમ્પ્સ ડ્યુટી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો માટે જમીનની કિંમતો નક્કી થાય છે તેનો આધાર લઈને શહેરના આ પ્રમાણે વિભાજન કરવામાં આવશે.

#### ફેક્ટર : ૨ મિલકતના બાંધકામના વર્ષ આધારિત ફેક્ટર

અ.નં.	મિલકતની ઉંમર	અવયવનો દર
૧	દશ વર્ષ કે તેથી ઓછા સમયની	૧.૦૦
૨	દશ વર્ષથી વધુ પરંતુ વીશ વર્ષ સુધી	૦.૮૫
૩	વીશ વર્ષથી વધુ પરંતુ ત્રીસ વર્ષ સુધી	૦.૭૦
૪	ત્રીસ વર્ષથી વધુ પરંતુ ચાલીસ વર્ષ સુધી	૦.૬૦
૫	ચાલીસ વર્ષ કરતાં વધુ સમયની	૦.૫૦

#### ફેક્ટર : ૩

##### (અ) રહેઠાણવાળી મિલકતોના પ્રકાર અંગેનો ફેક્ટર:

અમદાવાદ શહેરમાં રહેઠાણવાળી મિલકતોના જુદા જુદા પ્રકારો છે:

- (૧) ઝુંપડા (૨) ચાલી (૩) પોળ અને ગામતળના રહેઠાણવાળા મકાનો (૪) ફ્લેટ (૫) રોહાઉસ-ટેનામેન્ટ (૬) સ્વતંત્ર બંગલા

શહેરમાં આવેલી તમામ રહેણાંકની મિલકતોને ઉપરના પ્રકારો મુજબ વહેંચી તેના માટે નીચે મુજબના અવયવના દર રાખેલ છે.

અ.નં	મિલકતોનો પ્રકાર	અવયવનો દર
૧	ચાલી (૨૫ ચો.મી. કરતાં વધુ)	૦.૫૦
૨	પોળ અને ગામતળના રહેઠાણવાળા મકાનો	૦.૭૦
૩	ફ્લેટ	૦.૭૦
૪	રોહાઉસ, ટેનામેન્ટ	૧.૦૦
૫	સ્વતંત્ર બંગલા	૧.૫૦

##### (બ) બિનરહેઠાણવાળી મિલકતોના પ્રકાર અંગેનો ફેક્ટર:

અમદાવાદ શહેરમાં વસવાટ સિવાયની મિલકતો જેનો જુદા જુદા પ્રકારે વપરાશ થાય છે. વપરાશને લક્ષમાં લઈ નીચે મુજબનું વિભાજન કરવામાં આવેલ છે અને તેના અવયવો નીચે મુજબ રાખવામાં આવેલ છે.

ક(૧) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૭.૦

#### વાણિજિક હેતુઓ :

બેન્ક, દ્વાખાનું, હોસ્પિટલ, કલીનીક, પ્રસુતિગૃહ, લેબોરેટરી, કેન્દ્ર સરકારની કચેરી, રાજ્ય સરકારની કચેરી, સ્થાનિક મંડળોની કચેરી, પોસ્ટ ઓફિસ, વાણિજ્યિક અને/ અથવા ઔઘોગિક એકમોની કચેરી, ઓઈલ કું.ની ઓફિસ, વિવિધ કોપોરેશનની ઓફિસો, ટયુશન વર્ગો, ટાઈપીંગ સંસ્થા, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ અને આ ખંડના બીજા કોઈ પણ પેટા ખંડમાં આવતી ન હોય તે ઈમારતો

#### (૨) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૬.૦

દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો વગેરે:-

દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ, મનોરંજનના સ્થળો, ઓપન એર થીયેટર, પેટ્રોલ પંપ, સર્વીસ સ્ટેશન, સીનેમા, કલબ હાઉસ, જીમાખાના, કલબની મેસ, લોજંગ, લોજંગ એન્ડ બોર્ડિંગ, પાર્ટી ખોટ (કોમ્પ્યુનીટી હોલ સિવાય) ડિશ એન્ટેના, પેજર એન્ટેના ટાવર, સાઈન બોર્ડ, જાહેરખબરના પાઠીયા, મોબાઈલ ફોન ટાવર, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ.

#### (૩) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૨.૦

ઔઘોગિક એકમો અને કારખાના (ફક્ત ઉત્પાદન તથા પ્રોસેસીંગ કરતી ઈમારતો માટે):-

વીજળી કંપનીનું પાવર હાઉસ, વીજળી સબ-સ્ટેશન, એરેટર વોટર ફેકટરી, ભધા, બ્રાસ વર્ક્સ, બ્રિક અને સીરામીક વર્ક્સ, સીમેન્ટની વસ્તુઓ, કલે બનાવવાના એકમો, કેમીકલ ફેકટરી, કન્ફેક્શનરી, તેરી, રીસ્ટીલીયરી, ફાઉન્ડ્રી, ફલોર ફેકટરી, આયર્ન ફેકટરી, જીન્ક ફેકટરી, સીલ્વર ઓનમેન્ટ ફેકટરી, જગરી બનાવવાનું એકમ, લેધર મેન્યુફેક્ચરીંગ યુનિટ, ચુના ચકડી, ચુના ભટ્ટી, ઓઈલ એક્સટ્રેશન, પેપર મેન્યુ., પ્લાસ્ટીક ફેકટરી, પોટરી, સાગોળ મેન્યુ., સોપ મેન્યુ., સુગર મેન્યુ., ટીન ફેકટરી, તમાકુ ફેકટરી, વર્કશોપ, ફેકટરી સ્ટીમ ઝીલ, ઓટો ગેરેજ, ફેકટરી - એ, બી, સી, ઢી, ઈ, એફ, મીલ, પાવરલુમ, હેન્ડલુમ, બોર્ન વોશીંગ, બ્લીચિંગ, કોટન સ્પીનીંગ અને ડાઇગ, ડાઇગ બ્લીચિંગ, ધાણાણ ફેકટરી, લેધર પ્રોસેસીંગ, સ્કીન પ્રીન્ટિંગ, સલ્ફર પ્રોસેસીંગ, સ્ટાર્ચ પ્રોસેસીંગ, વરીયાળી પ્રોસેસીંગ, વુલ પ્રોસેસીંગ, કોલ્ડ સ્ટોરેજ, લાકડા પીઠા, ભઠીયારખાના, રીપેરીંગ વર્ક્સ, નર્સરી (હુલ છોડ), એનીમલ માર્કેટ, ઢોરના તબેલા, પોલ્ટી ફાર્મ, દુધાળા ઢોરનો તબેલો, વે બ્રીજ, બાઈન્ડીંગ પ્રેસ, પ્રિન્ટિંગ પ્રેસ, પ્રોસેસ સ્ટૂડીયો, ફોટો સ્ટૂડીયો, કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઉપરોક્ત ઈમારતોના ગોડાઉન તથા વેરહાઉસીસ

#### (૪) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં ૨.૦

શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ:-

ખાનગી નર્સરી (બાલમંદિર), ખાનગી અને સરકારી શાળાઓ, ખાનગી અને સરકારી કોલેજો, યુનિવર્સિટી કેમ્પસ, મ્યુઝીયમ, કોમ્પ્યુનિટી હોલ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સામાજિક સંસ્થાઓ (નારી સંરક્ષણ તથા ઉત્થાન, ધરડાધર, બહેરામુંગા, અંધજન, મંદબુધ્ય, શારીરિક ખોડખાંપણ સાથે સંકળાયેલી સંસ્થાઓ) તથા નોન ગ્રાન્ટેબલ શાળાઓ.

#### (૫) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં, મુકર્રર કરેલ દર વધારી શકાશે નહિ અથવા ધટાડી શકાશે નહિ:

પાણીની ટાંકી, વોટર પંપ રૂમ, ડ્રેનેજ પંપીંગ સ્ટેશન, ધોબીધાટ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવતી ગ્રાન્ટેબલ શાળાઓ, પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા ચલાવતી હોય તેવી બોર્ડિંગ-લોજંગ-હોસ્ટેલ, ધર્મશાળા, આશ્રમ, ગ્રંથાલય

#### (૬) નીચે પ્રમાણે ઉપયોગ કરેલ ઈમારતોના સંબંધમાં, મુકર્રર કરેલ દર ,૦.૦ વડે ગુણતાં જે આવે તેટલો ધટાડવો જોઈશે.

મંદિર, મસ્જિદી, દેરાસર (જૈન મંદિર), ચર્ચ, રોજા, કબર, ગુરુદ્વારા (શીખ મંદિર), અપાસરા, દરગાહ, અગિયારી, સમાધિ, ગ્રેબયાર્ડ, કબ્રસ્તાન, સ્મશાગૃહ, કુવો, હવાડો, હમામખાના (જાહેર બાથ), માટીના અખાડા, મદ્રેશા, પાઠશાળા, મફત પાણીની પરબ

#### ફેક્ટર : ૪ મિલકતનો ઉપયોગ કોણ કરે છે તેને આધારિત ફેક્ટર:

હાલમાં માલિક તાબે મિલકતોને ધણો જ ઓછો ટેક્સ ભરવો પડે છે જ્યારે ભાડુઆતને વધારે ટેક્સ આવે છે. બન્ને એકજ સરખી સવલતો ભોગવતા હોવા છતાં ટેક્સમાં મોટો તફાવત રાખવો યોગ્ય જણાતો નથી. તેથી નવી ફોર્મ્યુલામાં મોટો તફાવત નહીં રાખતા ભાડુઆત તાબે મિલકતને થોડી રાહત આપવાનું યોગ્ય જણાયું છે.

અ.નં	મિલકતનો ભોગવટા પરિબળ	અવયવ
૧	માલિકના ભોગવટાવાળી મિલકતો	૧.૦૦
૨	ભાડવાતના ભોગવટાવાળી મિલકતો	૨.૦૦

કલમ ૧૪૧ઈ (૧) તથા (૨) મુજબ શહેરની જે મિલકતો નોન-વોટર ઝોનમાં સમાવિષ્ટ થાય છે તેને તેના સામાન્ય કરમાં ૧૫% રિબેટ આપવામાં આવશે તથા બીનરહેણાંકવાળી ગ્રાઉન્ડ ફ્લોર સિવાયની મિલકતોના સામાન્ય કરમાં ૨૦% રિબેટ આપવામાં આવશે.

આમ છતાં, ઓછામાં ઓછો સામાન્ય વેરો નીચે મુજબ રહેશે.

(અ) રહેણાંકવાળી મિલકતો માટે:

અ.નં	મિલકતનો પ્રકાર	મિલકતનું માપ (ચો.મીટર)	લધુતમ સામાન્ય વેરો
૧	ઝુંપડા	--	૮૪.૦૦
૨	ચાલી	૨૫ ચો.મી. થી નાના	૨૬૪.૦૦
૩	અન્ય	૩૦ ચો.મી. થી નાના	૨૬૪.૦૦
૪	અન્ય	૩૦ ચો.મી. થી ૫૦ ચો.મી. સુધીના	૩૦૦.૦૦
૫	અન્ય	૫૦ ચો.મી. થી વધુ	૩૩૦.૦૦

ઝુંપડા માટે મહત્તમ લધુતમ સામાન્ય વેરો રૂ.૮૪/- તથા ૨૫ ચો.મી.થી નાના મકાનોવાળી ચાલીઓ માટે મહત્તમ લધુતમ સામાન્ય વેરો રૂ. ૨૬૪/- રહેશે.

(બ) બીનરહેણાંકવાળી મિલકતો માટે:

અ.નં	મિલકતનો પ્રકાર	મિલકતનું માપ (ચો.મીટર)	લધુતમ સામાન્ય વેરો
૧	બિનરહેણાંક	૧૫ ચો.મી. થી નાના	૫૪૦.૦૦
૨	બિનરહેણાંક	૧૫ ચો.મી. થી ૩૦ ચો.મી. સુધીના	૬૬૦.૦૦
૩	બિનરહેણાંક	૩૦ ચો.મી. થી વધુ	૭૮૦.૦૦
૪	પરિશીષ્ટ અને ઈ માંડિશવીલ બિનરહેણાંક	-----	૬૦૦.૦૦

વોટર ટેક્સ: સામાન્ય વેરાના ઉંઠું પ્રમાણે કોન્જરવન્સી ટેક્સ: સામાન્ય વેરાના ઉંઠું પ્રમાણે  
પાણીના મીટર કનેક્શન માટે પ્રોરેટા ચાર્જીસ પદ્ધતિ અનુસાર કનેક્શનની સાઈઝ પ્રમાણે વાર્ષિક પ્રોરેટા ચાર્જ નીચે મુજબ  
લેવાય છે.

માંગેલ કને.સાઈઝ	૧/૨ ઈંચ	
મેઠન લાઈનની સાઈઝ	ભરવાપાત્ર રકમ રૂપિયામાં	
	રહેઠાણ રૂ. ૩/-	કોમર્શિયલ રૂ. ૮/- એરકન્ડીશન/ ચણતર ફી રૂ. ૨૦/-
૩ ઈંચથી ૪ ઈંચ સુધી	૮૭૮/-	૨૩૪૪/-
૪ ઈંચથી વધુ અને ૮ ઈંચ સુધી	૧૦૬૫/-	૨૮૪૦/-
૮ ઈંચથી વધુ ૧૨ ઈંચ સુધી	૧૩૦૫/-	૩૪૮૦/-

૩/૪ ઈંચ			૧ ઈંચ		
ભરવાપાત્ર રકમ (રૂપિયામાં)			ભરવાપાત્ર રકમ (રૂપિયામાં)		
રહેઠાણ રૂ. ૩/-	કોમર્શિયલ રૂ. ૮/-	એરકન્ડીશન/ ચણતર ફી રૂ. ૨૦/-	રહેઠાણ રૂ. ૩/-	કોમર્શિયલ રૂ. ૮/-	એરકન્ડીશન/ ચણતર ફી રૂ. ૨૦/-
૨૪૨૪/-	૬૪૬૪/-	૧૬૧૬૦/-	૪૮૮૬/-	૧૩૨૮૬/-	૩૩૨૪૦/-
૨૮૫૮/-	૭૮૮૮/-	૧૮૭૨૦/-	૬૧૦૫/-	૧૬૨૮૦/-	૪૦૭૦૦/-
૩૬૨૭/-	૮૬૮૨/-	૨૪૧૮૦/-	૭૪૬૭/-	૧૮૮૧૨/-	૪૮૭૮૦/-

#### અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ નગરપાલિકા અને પંચાયતના વિસ્તારો માટે

બોંબે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ, ૧૯૪૮ની કલમ-૪૫૫ હેઠળ મળેલ સત્તાની રૂઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મિલકત વેરાની વસુલાત અંગે કારપેટ એરીયા બેઝ ફોર્મ્યુલા હેઠળ મિલકત વેરાની વસુલાત કરવા સંબંધિત ૨૦૦૧-૨૦૦૨થી અમલમાં મુકેલ બી.પી.એમ.સી. એક્ટની કલમ-૧૪૧(બી) મુજબની પ્રોપર્ટી ટેક્ષની કારપેટ એરીયા બેઈજ, નવી ફોર્મ્યુલાના શીડયુલ-એ, પ્રકરણ-૮માં નિયમ-૮(૪)નો ઉમેરો.

૮(૪) અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં ભેળવવામાં આવેલ વિસ્તારો માટે મિલકત વેરાના ખાસ નિયમો.

ગુજરાત સરકારશ્રીના જાહેરનામા ક્રમાંક: કેવી/૨૫/૨૦૦૬/એએમએન/૮૦૨૦૦૬/૪૧૦/પી, તા: ૧૪/૦૨/૨૦૦૬ થી ૭ (સાત) નગરપાલિકાઓના વિસ્તારોને તથા જાહેરનામા ક્રમાંક: કેવી/૨૧૧/૨૦૦૬/એએમએન/૮૦૨૦૦૬/૪૧૦/પી, તા: ૨૦/૦૭/૨૦૦૬ થી ૧૦(દસ) નગરપાલિકાઓ તથા ૩૦(ત્રીસ) ગ્રામપંચાયતોના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની હદમાં ભારતના બંધારણની કલમ ૨૪૩(ક્યુ)(૨) ની જોગવાઈ હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે. આ તમામ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની હદમાં સમાવવામાં આવતાં તેઓના વિસ્તારની

મિલકતોનો મિલકત વેરો બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૮ ની કલમ-૧૪૧(બી) મુજબ લેવાનો થાય છે પરંતુ આ વિસ્તારોના વિકાસને ધ્યાને રાખતાં આ વિસ્તારો સમાવતી વખતે જે મિલકતોની આકારણી થયેલ છે તેમજ જો કોઈ મિલકતની આકારણી થયેલ ન હોય પરંતુ તેનું બાંધકામ મહાનગરપાલિકામાં સમાવેશ થતાં પહેલાં પૂર્ણ થયેલ હોય તો તે અંગેના પુરાવા રજુ કરેથી આવી મિલકતો માટે લેવાનો થતો મિલકત વેરો તથા અન્ય કર/ચાર્જ નીચે મુજબના નિયમોથી લેવાના રહેશે.

૧. વર્ષ ૨૦૦૬-૨૦૦૭ માટે ઉપરોક્ત અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ કરાયેલ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોના વિસ્તારમાં આવેલ મિલકતોનો મિલકત વેરો જે તે નગરપાલિકા તથા ગ્રામ પંચાયતો પૈકી જ્યાં સમાવેશ થયા પહેલાં બીલીગ થયેલ ના હોય તેવા

વિસ્તારોમાં વર્ષ ૨૦૦૫-૨૦૦૬નું મિલકત વેરો/ધર વેરો તથા અન્ય કર/ચાર્જનું જે બીલ આપવામાં આવેલ છે તે મુજબ જ મિલકત વેરો/ધર વેરો તથા અન્ય કર/ચાર્જ લેવાના રહેશે અને જેમાં બીલીગ થઈ ગયેલ છે તેમાં તે બીલ મુજબ મિલકત વેરો લેવાનો રહેશે.

૨. વર્ષ ૨૦૦૭-૨૦૦૮થી ઉપરોક્ત વિસ્તારોમાં બી.પી.એમ.સી.એક્ટ, ૧૯૪૮ ની કલમ ૧૪૧(બી) મુજબ તથા તેના નિયમો ૮(ક) થી ૮(ચ) પ્રમાણે તથા અન્ય નિયમો મુજબ મિલકત વેરાની ગણતરી કરીને આખરી મિલકત વેરો તથા અમીાવી મહાનગરપાલિકા દ્વારા નક્કી કરેલ વોટર સુઅરેજ ચાર્જની મળી જે રકમ આવે તે રકમ જે તે નગરપાલિકા/ગ્રામ પંચાયતના સને ૨૦૦૬-૨૦૦૭ની મિલકત વેરા/ધર વેરા તથા અન્ય કર/ચાર્જ મળીને જે રકમ હોય તેના કરતાં વધારે થતી હોય તેવા ડિસ્સામાં આ બંનેના તફાવતની રકમમાં નીચે મુજબ વર્ષ પ્રમાણે વળતર આપવામાં આવશે.

- (અ) વર્ષ ૨૦૦૭-૨૦૦૮ના નાણાંકીય વર્ષ માટે ૭૫ ટકા વળતર આપવું.
- (બ) વર્ષ ૨૦૦૮-૨૦૦૯ના નાણાંકીય વર્ષ માટે ૫૦ ટકા વળતર આપવું.
- (ક) વર્ષ ૨૦૦૯-૨૦૧૦ના નાણાંકીય વર્ષ માટે ૨૫ ટકા વળતર આપવું.
- (ઢ) વર્ષ ૨૦૧૦-૨૦૧૧ના નાણાંકીય વર્ષથી ક્ષેત્રફળ આધારિત નવી પદ્ધતિ મુજબ ટેક્ષ લેવામાં આવશે.

પરંતુ આ વળતર બીજી જે રકમ રહે તે મહાનગરપાલિકા માટે કલમ-૧૪૧(બી)(૫) મુજબ જે ઓછામાં ઓછો કર રાજ્ય સરકારે નક્કી કરેલ છે તથા નક્કી કરેલ વોટર સુઅરેજ ચાર્જ કરતાં ઓછો થવો જોઈએ નહીં.

#### શિક્ષણ ઉપકરના દર:

શિક્ષણ ઉપકરના દરો ગુજરાજ એક્ટ નં. ૧૦ ઓફ ૨૦૦૬ તા. ૩૧-૩-૨૦૦૬ નીચે મુજબ છે.

મિલકત વેરો	શિક્ષણ વેરાનો દર	
	રહેઠાણ	બીનરહેઠાણ
રૂ.૨૦૦ થી વધુ પરંતુ રૂ.૫૦૦ કે તેથી ઓછા મિલકતવેરા માટે	૫ ટકા	૧૦ ટકા
રૂ.૫૦૦ થી વધુ પરંતુ રૂ.૩૦૦૦ કે તેથી ઓછા મિલકતવેરા માટે	૧૦ ટકા	૨૦ ટકા
રૂ.૩૦૦૦ થી વધુ મિલકતવેરા માટે	૧૫ ટકા	૩૦ ટકા

## વ્યવસાયવેરા વિભાગ

રાજ્ય સરકારે તા.૦૧-૧૦-૨૦૦૬ થી વ્યવસાયવેરાની કામગીરી અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનને કલેકટીંગ એજન્ટ તરીકે સૌપેલ. ત્યારબાદ તા. ૧-૪-૨૦૦૮ થી અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનને ડેજીનેટેડ ઓથોરીટી તરીકે વેરો લાદવાની તથા વસુલ કરવાની તમામ કામગીરી સૌપવામાં આવેલ છે. વ્યવસાયવેરાને પાત્ર નવા કરદાતાઓની નોંધણી, જુના કરદાતા અને નવા કરદાતાઓની બાકી વેરાની વસુલાતની કામગીરી આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરાને લગતી તમામ કામગીરી ઝોન પ્રમાણે કરવામાં આવે છે.

### **વ્યવસાયવેરા ખાતાની કામગીરી:**

વ્યવસાયવેરા ખાતા દ્વારા વ્યવસાયવેરાને પાત્ર થતા હોય તેવા એનરોલમેન્ટ સર્ટિફિકેટ હોલ્ડર (ઈ.શી.હોલ્ડર) અને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ હોલ્ડર (આર.સી.) ની વેરો લાદવાની તથા વસુલ કરવાની કામગીરી જે તે ઝોન દ્વારા ઉપર જણાવેલ અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. વ્યવસાયવેરો ભરવા માટે વ્યક્તિએ નીચે મુજબની કાર્યવાહી કરવાની થાય.

૧. એનરોલમેન્ટ સર્ટિફિકેટ: એનરોલમેન્ટ સર્ટિફિકેટ અ.ખુ.કોર્પોરેશનની હુદમાં વ્યવસાય કરતાં ડેક્ટરો, વકીલો, એજન્ટો, કન્સલ્ટન્ટ, દુર ટ્રાવેલ ઓપરેટરો, કમિશન એજન્ટો, એડવર્ટિઝીંગ એજન્સી, શેર દલાલો, ભાગીદારી પેટીઓ, ફેક્ટરીઓ, ગુમાસ્તાધારા હેઠળ નોંધાયેલ તમામ પેટીઓ, પબ્લિક અને પ્રાઇવેટ લીભીટેડ કંપનીઓ, નાણાં ધીરનારાઓ, સ્ટેમ્પ વેન્ડરો વિગેરે (વિગતવાર લીસ્ટ શીડ્યુલ ૧ ની એન્ટ્રી નં.૨ થી ૧૦ જોવુ) ને તા. ૧-૪-૨૦૦૮ થી પોતે અમદાવાદ ખુનિસિપલ કોર્પોરેશનની હુદમાં દરેક બ્રાન્ચ માટે નોંધણી કરાવી રૂ.૨૦૦૦/- વ્યવસાયવેરો અ.ખુ.કોર્પોરેશનના કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર તા. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ભરવાને પાત્ર થાય છે.

જે વ્યવસાયકારો વેટ હેઠળ ડીલર તરીકેની વ્યાખ્યામાં સમાવેશ થતો હોય તેમણે તા. ૧-૪-૨૦૦૮ થી નીચે મુજબ વાર્ષિક વ્યવસાયવેરો ભરવાનો થાય છે.

૧. રૂ.૨,૫૦,૦૦૦/- સુધી ટર્ન ઓવર હોય તો શૂન્ય
૨. રૂ.૨,૫૦,૦૦૦/- થી રૂ.૪,૮૮,૮૮૮/- રૂ.૫૦૦/-
૩. રૂ.૫,૦૦,૦૦૦ થી રૂ.૮,૮૮,૮૮૮/- રૂ.૧૨૫૦/-
૪. રૂ.૧૦,૦૦,૦૦૦ થી વધુ રૂ.૨૪૦૦/-

એનરોલમેન્ટ સર્ટિફિકેટ મેળવવા માટે વ્યવસાયકારે ફોર્મ નં.૩ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્સ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાર્ડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જેવા આનુષ્ઠાંગિક પુરાવાઓ રજુ કરવા જોઈએ.

ફોર્મ નં.૩ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા ઝોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્સ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.ખુ.કોર્પોરેશનની વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર પ્રોફેશનલ ટેક્સમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકાશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક / ડીમાન્ડ પ્રાફ્ટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો ખુનિસિપલ

કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકાશે.ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામું, ટેલિફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલાણની જરૂરિયાત નથી.

**૧. રજીસ્ટ્રેશન સટીફિકેટ:** (આર.સી.) રજીસ્ટ્રેશન સટીફિકેટ અ.ભ્ય.કોપોરિશનની હદમાં જે એમલોયર એક અથવા તેથી વધુ કર્મચારીઓને નોકરીએ રાખતા હોય અને તેઓ પગાર અથવા વેતનની ચુકવણી કરતાં હોય તેમણે રજીસ્ટ્રેશન સટીફિકેટ મેળવવું ફરજીયાત છે.

રજીસ્ટ્રેશન સટીફિકેટ મેળવવા માટે એમલોયરે ફોર્મ નં. ૧ માં જરૂરી વિગતો ભરી પ્રોપર્ટી ટેક્સ બીલની નકલ, ગુમાસ્તાધારા હેઠળ નોંધણીની નકલ, પાન કાડની નકલ, કંપની નોંધણીની નકલ, વેટ હેઠળ નોંધણીની નકલ જેવા આનુષ્ઠાંગિક પુરાવાઓ રજી કરવા જોઈએ.

ફોર્મ નં. ૧ કોઈપણ સીટી સીવીક સેન્ટર અથવા જોનલ ઓફિસ પ્રોફેશનલ ટેક્સ વિભાગમાંથી વિનામુલ્યે ઉપલબ્ધ છે. તેમજ આ ફોર્મ અ.ભ્ય.કોપોરિશનની વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર પ્રોફેશનલ ટેક્સમાં લીન્ક કરી ડાઉનલોડ કરી કોપી કાઢી શકાશે. વ્યવસાયવેરો ભરવા માટે કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર રોકડેથી અથવા ચેક / ડીમાન્ડ પ્રાફ્ટ અમદાવાદ ખાતે પેયેબલ હોય તેવો ખુનિસિપલ કમિશનર, અમદાવાદ નામનો લખી ભરી શકાશે.ચેકની પાછળ નોંધણીનો નંબર, અરજદારનું નામ, સરનામું, ટેલિફોન નંબરની વિગત દર્શાવવી. વ્યવસાયવેરો ભરવા માટે કોઈ ચલાણની જરૂરિયાત નથી.

જે એમલોયરે ૨૦ કે તેથી ઓછા કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલા દરો મુજબ વેરો કાપી દર ત્રણ માસ પુરા થયા બાદ દિન-૧૫ માં તેમજ જે એમલોયરે ૨૦ થી વધુ કર્મચારીઓ નોકરી ઉપર રાખ્યા હોય તેમણે નીચે જણાવેલા દરો મુજબ વેરો કાપી દર માસે માસ પુરો થયાના દિન-૧૫ માં કોઈપણ સીટી સીવીક સેન્ટર ઉપર વ્યવસાયવેરો ભરવાનો થાય.

### વેરાનો દર (૨૦૧૩-૨૦૧૪)

ક્રમ	માસિક પગાર / વેતનની રકમ રૂ.	વ્યવસાયવેરાનો દર રૂ.
૨	રૂ.૬૦૦૦ થી ઓછા	શુન્ય
૩	રૂ.૬૦૦૦/- અથવા તેથી વધુ પરંતુ રૂ.૮૦૦૦ થી ઓછા	૮૦/-
૪	રૂ.૮૦૦૦/- અથવા તેથી વધુ પરંતુ રૂ.૧૨૦૦૦ થી ઓછા	૧૫૦/-
૫	રૂ.૧૨૦૦૦/- અથવા તેથી વધુ	૨૦૦/-

ખાસ નોંધ:- રાજ્ય સરકારે તા. ૧-૪-૨૦૦૮ થી અમલી બને તે રીતે શીડ્યુલ-૧ એન્ટ્રી નં. ૧ એ જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, પંચાયત તેમજ પબ્લિક સેક્ટર અન્ડરટેક્ઝિંગ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ૧૦૦% ગ્રાન્ટ લેતી સંસ્થાઓ સિવાયના તમામ એમલોયરને ફરજિયાતપણે અમદાવાદ ખુનિસિપલ કોપોરિશનની હદમાં હોય તેમણે એમલોયર તરીકેનો વ્યવસાયવેરો અમદાવાદ ખુનિસિપલ કોપોરિશનમાં સીટી સીવીક સેન્ટર ઉપર ભરવાનો થાય જેની જાહેર જનતાને જાણ કરતી જાહેરત તમામ અગ્રગણ્ય અભિબારોના છેલ્લા પાના ઉપર તા. ૨૧-૪-૨૦૦૮ અને તા. ૮-૫-૨૦૦૮ ના રોજ આપવામાં આવેલ છે.

**અરજી / ફરજિયાદ:** વ્યવસાયવેરાની લગતી કોઈપણ પ્રકારની અરજી કે ફરજિયાદ અથવા રજીઆત જોનલ ઓફિસના પ્રોફેશન ટેક્સ વિભાગમાં આપી શકાશે.

વ્યવસાયવેરાની માહિતી

વ્યવસાયવેરાના દર, ફોર્મ નં. ૧, ફોર્મ નં. ૩, ફોર્મ નં. ૫ વ્યવસાયવેરો કોને લાગુ પડે છે તેની વિગતો તેમજ વ્યવસાયવેરાને લગતા મશ્વો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

**(૬) નિયંત્રણ હેઠળના દસ્તાવેજોના વર્ગોનું પત્રક :**

મિલ્કટના મ્યુનિ.ટેક્ષના ડિમાન્ડ, માગણાની રકમ, ટેક્ષ ભર્યાની તથા બાકી ટેક્ષની કોમ્પ્યુટરાઈડ વિગતો તથા કરદાતાની અરજીઓ, નિકાલની કાર્યવાહીની વિગતો વેબસાઈટ પર મુકવામાં આવેલ છે.

**(૭) નીતિ અથવા તેના અમલીકરણના ઘડતર સંબંધમાં જનતાના સત્યોસાથે વિચાર વિનિમયની ગોઠવણાની વિગતો :**

જે-તે વોર્ડના વોર્ડ ઈન્સપેક્ટર, જે-તે બીટના ડીવીઝનલ સુપ્રિન્ટેન્ટ, વિભાગના આસી.મેનેજર, હગોનના ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટરશ્રી કક્ષાના અધિકારી/કર્મચારીનો જે-તે કરદાતા મ્યુનિ.ટેક્ષના પ્રશ્ન/મુશ્કેલી તથા અરજીના નિકાલ જેવી બાબતે રૂ/૦૦ થી રૂ/૩૦ દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકે છે.

**(૮) બોર્ડ વિ.બેઠકો લોકો માટે ખુલ્લી છે, બેઠકોની કાર્યનોંધ લોકોને મળવાપાત્ર છે કે કેમ? :-**

આ વિભાગને લાગુ પડતું નથી.

**(૯) અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા:-**

**(૧૦) તેઓને મળતા માસિક વળતર :-**

**બીટ વિભાગની કચેરી તથા અધિકારીની માહિતી**

કચેરીનું સ્થળ :- બી બ્લોક નંબર બિલ્ડિંગ, ફર્સ્ટ ફ્લોર, સરદાર પટેલ ભવન દાણાપીઠ અમદાવાદ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર
૧	શ્રી નાગરાજન નાયડુ	ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર -૯૮૨૮૧૬૮૭૨૮
૨	શ્રી વીણાબેન પટેલ	આસી.મેનેજર -૯૭૬૦૯૬૮૦૩
૩	શ્રી પ્રણવ યુ. બારોટ	આસી.મેનેજર -૯૭૭૪૮૨૩૮૭
૪	શ્રી હરદેવસિંહ જાદવ	આસી.મેનેજર -૯૨૭૦૩૮૭૮૫

## શિરસ્તેદાર ખાન્ય

અનુ નં.	નામ	હોદ્દો
૧	બાબીબેન રાજપુત	જુની.લીગલ આસી.
૨	શ્રી નીતાબેન ધરમદાસાણી	શિરસ્તેદાર
૩	શ્રી વિમળાબેન હેડંબા	૩. શિરસ્તેદાર
૪	શ્રી નીપા મોઢી	જુની.કલાર્ક
૫	શ્રી પંકજબેન મુકુલ	ડિસ્પેચ કલાર્ક
૬	શ્રી અનુજી એચ. બંધેરીયા	સીની.કલાર્ક
૭	શ્રી ધવલ ચૌધરી	ઠરાવ કલાર્ક
૮	શ્રી હીનાબેન ઠક્કર	કન્ટીજન્સી કલાર્ક-બીલ કલાર્ક
૯	શ્રી રાજેશ દેવલેકર	જુની.કલાર્ક-કેશીયર
૧૦	શ્રી દિનેશભાઈ પરમાર	જુની.કલાર્ક-કેશીયર

## શાહપુર બીટ

અનુ નં.	નામ	હોદ્દો	બીટ/વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી રસુલભાઈ આર. રાઠવા	ડીવી.સુપ્રિ.	શાહપુર બીટ	૧૨૨ થી ૧૨૮
૨	શ્રી હર્ષદ વસંતલાલ વડસરા	વોર્ડ ઇન્સ્પેક્ટર	શાહપુર	૦૧૨૨
૩	શ્રી ઠાકોર વિનોદ લક્ષ્મણજી	જુનીયર કલાર્ક	રેટીયાવાડી	૦૧૨૩
૪	શ્રી મુકેશભાઈ પટેલ (ચાઈ)	વોર્ડ ઇન્સ્પેક્ટર	હલીમની ખડકી	૦૧૨૪
૫	શ્રી ઠાકોર વિનોદ લક્ષ્મણજી (ચાઈ)	જુનીયર કલાર્ક	રંગીલા શેરી	૦૧૨૫
૬	શ્રી ધર્મન્દ્રસિંહ સી. ચૌધરી	વોર્ડ ઇન્સ્પેક્ટર	મીરજાપુર	૦૧૨૬
૭	શ્રી હન્જલા પ્રાયમસવાલા	વોર્ડ ઇન્સ્પેક્ટર	ખાનપુર	૦૧૨૭
૮	શ્રી રમેશભાઈ બી. વાવેલા	વોર્ડ ઇન્સ્પેક્ટર	વાડીગામ	૦૧૨૮

### માણુપુરા બીટ

અનુ નં.	નામ	હોદો	બીટ/વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી નીતાબેન ધરમદાસાણી	ડીવી.સુપ્રિ.	૦૧૨૯-૦૧૩૦	
૧	શ્રી દલસુખભાઈ રાઠવા	ડીવી.સુપ્રિ.	૦૧૩૧-૦૧૩૫	
૨	શ્રી પ્રભુભાઈ પી. ભરવાડ(ચાજી)	વોર્ડ ઇન્સ્પેક્ટર	ભંડેરી પોળ	૦૧૨૮
૩	શ્રી છબાભાઈ જી. પટેલ	જુનીયર કલાર્ક	ઉભગરવાડ	૦૧૩૦
૪	શ્રી રમેશભાઈ બી. વાધેલા(ચાજી)	જુની.કલાર્ક	જોડન રોડ	૦૧૩૧
૫	શ્રી પ્રભુભાઈ પી ભરવાડ	વોર્ડ ઇન્સ્પેક્ટર	જુના સ્ટાફ કુવા	૦૧૩૨
૬	શ્રી ધર્મન્દ્રસિંહ સી. ચૌધરી(ચાજી)	જુની.કલાર્ક	મહેંદી કુવા	૦૧૩૩
૭	શ્રી હંજલા એ. પ્રાયમસવાલા	વોર્ડ ઇન્સ્પેક્ટર	તાવડી પુરા	૦૧૩૪
૮	શ્રી શૈલેષ જી. ઠક્કર(ચાજી)	જુની.કલાર્ક	દુધેશ્વર	૦૧૩૫

### શાહીબાગ બીટ

અનુ નં.	નામ	હોદો	બીટ/વોર્ડનું નામ	વોર્ડ નંબર
૧	શ્રી દલસુખભાઈ સી.રાઠવા	ડીવી.સુપ્રિ.	૦૧૩૬-૦૧૪૧	
૨	શ્રી શૈલેષ જી. ઠક્કર	વોર્ડ ઇન્સ્પેક્ટર	હાજુપુરા ગાર્ડન	૦૧૩૬
૩	શ્રી ભરતભાઈ એ. પરમાર	જુનીયર કલાર્ક	ગુજરાત જનીગ	૦૧૩૭
૪	શ્રી મહેન્દ્રસિંહ પી. રાજપુત(ચાજી)	જુનીયર કલાર્ક	ગિરધરનગર	૦૧૩૮
૫	શ્રી મુકેશ પી. પટેલ	વોર્ડ ઇન્સ્પેક્ટર	ઉફનાળા	૦૧૩૯
૬	શ્રી મહેન્દ્રસિંહ પી. રાજપુત(ચાજી)	જુનીયર કલાર્ક	જહાંગીરપુરા	૦૧૪૦
૭	શ્રી મહેન્દ્રસિંહ પી. રાજપુત	જુનીયર કલાર્ક	સીવીલ હોસ્પિટલ	૦૧૪૧

## ખાડીયા રાયખડ તથા કાલુપુર બીટની કામગીરી :-

**કચેરીનું સ્થળ :-** બી બ્લોક નવુ બિલ્ડીંગ, મેજનીન ફ્લોર, સરદાર પટેલ ભવન દાણાપીઠ અમદાવાદ

અનુંન.	નામ	હોદ્દો	બીટ/વોર્ડનું નામ	વોર્ડનું નામ
૧	શ્રી રસુલભાઈ રાઠવા	ડીવી.સુપ્રિ.	ખાડીયાબીટ	૦૧૦૧-૦૧૦૭, ૦૧૪૨ અને ૦૧૪૩
૨	શ્રી કમલેશ સોની	જુની.કલાર્ક	૦૧૦૧	પાંચકુવા
૩	શ્રી સંજય એસ. ભંડ	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૨	ખાડીયા ગેટ
૪	શ્રી મેહુલ બી શાહ	જુની.કલાર્ક	૦૧૦૩	રાયપુર
૫	શ્રી જયતેભાઈ વી.સાંસિયા (ચાજી)	જુની.કલાર્ક	૦૧૦૪	ઢાળની પોળ
૬	શ્રી સંજય એસ. ભંડ (ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૫	ચકલેશ્વર મહાદેવ
૭	શ્રી કમલેશ સોની (ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૬	સાંકડી શેરી
૮	શ્રી ધવલ બી. ભંડ(ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૭	માણેકચોક
૯	શ્રી ધવલ બી. ભંડ (ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૪૨	ન્યુ કલોથ માર્કેટ
૧૦	શ્રી મેહુલ બી શાહ(ચાજી)	જુની.કલાર્ક	૦૧૪૩	ગીતામંડિર

## રાયખડ બીટ

અનુંન.	નામ	હોદ્દો	બીટ/વોર્ડનું નામ	વોર્ડનું નામ
૧	શ્રી પ્રહૃતાદભાઈ મનાત	ડીવી.સુપ્રિ.	રાયખડબીટ	૦૧૦૮-૦૧૧૪
૨	શ્રી સંજય એસ.ભંડ( ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૦૮	માંડવીની પોળ
૩	શ્રી મહેમદઅલી હુસેનભિયા મિરજા	જુનીયર કલાર્ક	૦૧૦૯	તાજપુર
૪	શ્રી કમલેશ આર. પારેખ	જુનીયર કલાર્ક	૦૧૧૦	ખમાસા
૫	શ્રી મહેમદઅલી હુસેનભિયા મિરજા(ચાજી)	જુનીયર કલાર્ક	૦૧૧૧	સ્લોટર હાઉસ
૬	શ્રી સલીમ ગુલામએહમદ મોમીન	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૨	ગાયકવાડ હવેલી
૭	શ્રી સલીમ ગુલામએહમદ મોમીન (ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૩	ભદ્ર
૮	શ્રી અલ્પેશ બી.ચૌધરી	વોર્ડ ઈન્સ્પેક્ટર	૦૧૧૪	નવી મહોલાત

## કાળુપુર બીટ

અનુ નં.	નામ	હોદ્દો	બીટ/વોર્ડનું નામ	વોર્ડનં.
૧	શ્રી લક્ષ્મણભાઈ બારા	ડીવી.સુપ્રિ.	કાળુપુર બીટ	૦૧૧૫-૦૧૨૧
૨	શ્રી અલ્પેશ બી. ચૌધરી (ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	રેવડી બજાર	૦૧૧૫
૩	શ્રી વિનોદ એમ. પટેલ	વોર્ડ ઈન્સ્પેક્ટર	ટકશાળ	૦૧૧૬
૪	શ્રી કલ્પેશ આર. વાળંદ	જુનીયર કલાર્ક	દોશીવાડાની પોળ	૦૧૧૭
૫	શ્રી કલ્પેશ આર. વાળંદ(ચાજી)	જુનીયર કલાર્ક	દેવશાનો પાડો	૦૧૧૮
૬	શ્રી વિનોદ એમ. પટેલ(ચાજી)	વોર્ડ ઈન્સ્પેક્ટર	પાંજરાપોળ	૦૧૧૯
૭	શ્રી જયંતિભાઈ વી. સાંસિયા (ચાજી)	જુનીયર કલાર્ક	પટવા શેરી	૦૧૨૦
૮	શ્રી કમલેશ આર. પારેખ(ચાજી)	જુનીયર કલાર્ક	ધી કાંટા	૦૧૨૧
૯	શ્રી નમૃતાભેન દુબે	ડી.સુ. કલાર્ક		

## મધ્યઝોન વ્યવસાયવેરા વિભાગ

**કચેરીનું સ્થળ :-** બી બ્લોક જુનુ બિલ્ડીંગ, પાંચમો માળ, સરદાર પટેલ ભવન ,દાણાપીઠ ,અમદાવાદ

અનુ નં.	નામ	હોદ્દો તથા ફોન નંબર	વ્યવસાયવેરા તથા ગુમાસ્તાધારા વોર્ડ કમાંક
૧	શ્રી નાગરાજન નાયુ	૩.એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર ૮૩૨૮૧૮૮૭૨૮	જોનના ખાતાના અધિકારી
૨	શ્રી પ્રષાંત યુ. બારોટ	આસી.મેનેજર ૮૩૭૭૪૮૨૩૮૭	સંકલન
૩	શ્રી નરેન્દ્રભાઈ એસ. ડામોર	ઓ.એસ.	૧૦૧ થી ૧૪૩
૪	શ્રી વાસવ શાહ	જુની કલાર્ક	૧૦૧ થી ૧૦૮, ૧૪૩
૫	શ્રી રાજકુમારસિંહ વી. રાઠેઠ	સીની. કલાર્ક	૧૦૮ થી ૧૧૬
૬	શ્રી રમેશભાઈ ડી. મકવાણા	સીની.કલાર્ક	૧૧૭ થી ૧૨૫, ૧૨૬ થી ૧૩૩, ૧૪૨
૭	શ્રી રામચંદ્ર એસ. ચૌહાણ	જુની કલાર્ક	૧૩૪ થી ૧૪૧

### (૧૧) આર્થિક સહાય કાર્યક્રમો :-

આ વિભાગને લાગુ પડતું નથી.

## (૧૨) આપેલ છુટણાર વિગેરે :-

બી.પી.એમ.સી.એક્ટ ૧૯૪૮ ની જોગવાઈઓ, વખતોવખતના પરિપત્રો, આદેશ, જોગવાઈઓ સક્ષમ સત્તાની મંજુરી મુજબ બંધ ખાલી/ઇન્સ્ટીવ રીબેટ વિગેરે લાભ આપવામાં આવે છે.

## (૧૩) ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ વિગતો :-

ટેનામેન્ટ નંબર આધારિત ભિલ્કતના ટેક્ષને લગતી તમામ માહિતી કોમ્પ્યુટરમાં અ.ભ્ય.કો.ની વેબસાઈટ [www.ahmedabadcity.gov.in](http://www.ahmedabadcity.gov.in) પર ઉપલબ્ધ છે.

## (૧૪) ગ્રંથાલય અને વાંચનાલયની સુવિધાઓની વિગતો :-

આ વિભાગને લાગુ પડતું નથી.

## (૧૫) જાહેર માહિતી અધિકારીઓના નામો અને હોદ્દાઓ :-

મે.ભ્યનિસિપલ કમિશનરશ્રીના હુકમ ઓફસ ઓર્ડર નં ૧૪૦ તા. ૧૭/૦૩/૨૦૧૫ મુજબ નિમણૂકની વિગત

અ.નં	નામ	ખાતાનો હોદ્દો	માહિતી અધિકારની જવાબદારી	કાર્યક્ષેત્ર
૧	શ્રી સૌરભ પટેલ	આસી.ભ્યનિ.કમિશનર	સબંધિત જોન ના પ્રથમ અપીલ અધિકારી	સબંધિત જોનની સંકલિત માહિતી માટે
૨	શ્રી નાગરાજન નાયુ	ડે.એસેસર એન્ડ ટેક્ષ કલેક્ટર	જાહેર માહિતી અધિકારી સબંધિત જોન તથા પ્રથમ અપીલ અધિકારી	મધ્યગોન પ્રોપર્ટી ટેક્ષ તથા પ્રોફેશન ટેક્ષ (સંકલીત માહિતી)
૩	શ્રી વીણાબેન પટેલ	આસી.મેનેજર	જાહેર માહિતી અધિકારી	મધ્યગોન ટેક્ષ ખાડીયા, રાયખડ, કાલુપુરબીટ
૪	શ્રી પ્રધાવ બારોટ	આસી.મેનેજર	જાહેર માહિતી અધિકારી	મધ્યગોન પ્રોફેશન ટેક્સ-ટેક્સ શાહપુર અને માધુપુરા બીટ
૫	શ્રી હરદેવસિંહ જાદવ	આસી.મેનેજર	જાહેર માહિતી અધિકારી	ટેક્ષ મધ્યસ્થ કચેરી-શાહીબાગ બીટ

## (૧૬) ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી :-

આ વિભાગને લાગુ પડતું નથી.

મે.ડે.ભૂનિ.કમિશનર સાહેબ  
(મધ્યઝોન)

આર.ટી.આઈ.ના નિયમો અનુસાર મધ્યઝોન ટેક્સ ખાતાનું વર્ષ ૨૦૧૭-૧૮ નું  
પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર આ સાથે સામેલ છે. સદરહુ પ્રો-એક્ટીવ ડિસ્કલોઝરની સોફ્ટ કોપી  
ભૂનિ.કોપોરેશનની વેબસાઇટ પર મુકવા આપ સાહેબની મંજુરી આપવા વિનંતી છે.

આસી.મેનેજર  
(મધ્યઝોન ટેક્સ)

ડે.એસેસર એન્ડ ટેક્સ કલેક્ટર  
(મધ્યઝોન)

આસી.ભૂનિ.કમિશનર  
(મધ્યઝોન)

ડે.ભૂનિ.કમિશનર  
(મધ્યઝોન)